

# શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ


બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા એનાયત કરાતા પ્રસિદ્ધ ‘ગુજરાત-ગીરનાર એવોક સમારોહ’માં  
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના નવમાં વંશજ અને વિદ્યમાન પ.પૂ. સનાતન ધ.ধ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અણેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના  
પનોતી સત્યુત્ર પ.પૂ.૧૦૮ શ્રી ધમકુળ મુગટમણિ શ્રી વૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનું વર્ષ - ૨૦૧૧ના સર્વોચ્ચ  
(‘ગુજરાતી ગૌરવ એવોક’થી સન્માન... (તા. ૨૨-૧-૨૦૧૨ મલાડ)

સંપ્રદાયનો સર્વાંગી વિકાસ કરતું શ્રી સ્વા. મંદિર - સરધારનું મુખ્યપત્ર

# ચિંતન

ફેબ્રુઆરી - ૨૦૧૨

બે વર્ષ લવાજમ રૂ.૧૬૦/-



પ.પૂ. વાલશુ મહારાજશ્રી સાથે બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજ ટ્રસ્ટીમંડળના સભ્યશ્રીઓ

પ.પૂ. વાલશુ મહારાજશ્રીને સર્વોચ્ચ ‘ગુજરાતી ગૌરવ એવોક’ અર્પણ કરતા પ્રમુખ શ્રી દેમરાજભાઈ શાહ

પ.પૂ. વાલશુ મહારાજશ્રીના વરદ દ્વારા ‘ગીરનાર એવોક’ સ્વીકરણ વિવિધ શૈક્ષણા પ્રતિકિંઠ ગુજરાતીઓ



**મલાડ ખાતે પ.પુ. લાલજી મહારાજશ્રીના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલ ગુજરાત ગૌરવ-ગીરનાર એવોર્ડ સમારોહ માં 'ગીરનાર એવોર્ડ' સ્વીકારતા વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત ગુજરાતીઓ**

૧. પ.પુ. લાલજી મહારાજશ્રીનું પુષ્પહાર અર્પણ કરીને સ્વાગત કરતા મલાડના ઉત્સાહી નિહાવાન સત્સંગી પ.ભ. શ્રી જ્યંતિભાઈ મોટી. ૨. એન.આર.આઈ. એવોર્ડ સ્વીકારતા શ્રી વિજય ઠાકોર - હોંગકોંગ. ૩. સાહિત્ય રલ એવોર્ડ સ્વીકારતા શ્રી અનીલ જોધી.
૪. નાટ્ય રલ એવોર્ડ સ્વીકારતા શ્રી અરવિંદ રાડોડ. ૫. નાટ્ય લેખન એવોર્ડ સ્વીકારતા શ્રી પ્રવિષા સોલંકી. ૬. શ્રેષ્ઠ મ્યુઝિક ડિરેક્ટર એવોર્ડ સ્વીકારતા શ્રી હિમેશ રેશમીયા વતી તેઓના પિતાશ્રી વિપીનભાઈ રેશમીયા. ૭. પ્લેબેક સીંગર એવોર્ડ સ્વીકારતા શ્રી પ્રાર્થિવ ગોહિલ. ૮. વ્યાપાર-ઉદ્યોગ એવોર્ડ સ્વીકારતા શ્રી મુકેશ ગાલા. ૯. શ્રી દામજ ગાલા. ૧૦. શ્રી કાનજ રીતા. ૧૧. શ્રી વિશાલ કારીયા.
૧૨. શ્રી રામજ શાહ.



વડતાલ પ્રદેશના ખુલાડ (તા. સંભેડ) ગામને આંગણે પ.પૂ. લાલજી મહારાજશ્રીના સાંનિધ્યમાં યોજાયેલ સરથારનિવાસી પૂ. સ.ગુ. ત્યામી શ્રી નિત્યલ્યાપદાસજીના માર્ગદર્શન પ્રમાણે તૈયાર બ્યેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનો 'મૂર્તિ પ્રાપ્ત પ્રતિકા મહોત્સવ' (તા. ૨૪ થી ૨૮-૧-૨૦૧૨)



વડતાલ પ્રદેશના નાંદોલી (તા. માતર) ગામને આંગણે પ.પૂ. લાલજી મહારાજશ્રીના સાંનિધ્યમાં યોજાયેલ સરથારનિવાસી પૂ. સ.ગુ. ત્યામી શ્રી નિત્યલ્યાપદાસજીના માર્ગદર્શન પ્રમાણે તૈયાર બ્યેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનો 'મૂર્તિ પ્રાપ્ત પ્રતિકા મહોત્સવ' (તા. ૨૭ થી ૩૧-૧-૨૦૧૨)



વડતાલ પ્રદેશના આણંદ શહેરને આંગણે પ.પૂ. લાલજી મહારાજશ્રીના સાંનિધ્યમાં યોજાયેલ શ્રીછ્રાસાદિભૂત જગ્યામાં તૈયાર બ્યેલ નૂતન શ્રી સહજનાં સ્રુતિ મંદિરનો 'મૂર્તિ પ્રાપ્ત પ્રતિકા મહોત્સવ' (તા. ૨૮ થી ૨-૨-૨૦૧૨)



### દાઈંક અમિનંદન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ગૌરવ

પ.પૂ. ઘ.થુ. આચાર્ય મહારાજશ્રી તથા પ.પૂ. લાલજી મહારાજશ્રીના રૂડા આચીર્વાદશી સરથારનિવાસી પૂ. સ.ગુ. ત્યામી શ્રી નિત્યલ્યાપદાસજીના દૃપાપાત્ર હિણ્ય પૂ. શ્રી યોગેશરાલજી ત્યામીને નવ્ય વ્યાકરણ આચાર્ય (અભ.એ.)માં ફર્સ્ટ કલાસ નંબર મેળવ્યા બાદ સોમનાય સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા લેવાયેલ શ્રી સ્વામિનારાયણ વેદાંત આચાર્ય (અભ.એ.)ની પરિસ્થિતિમાં ડલત સુવર્ણાંકિંડક પ્રામ કરીને સંપ્રદાયનું ગૌરવ વધાર્યું છે. તે બદલ તેઓને દાઈંક અમિનંદન...






વડતાલ પ્રદેશના દેખતી (તા. માતર) ગામને આંગણે પ.પૂ. લાલજી મહારાજશ્રીના સાંનિધ્યમાં યોજાયેલ સરધારનિવાસી પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યાવૃપદાસજ્ઞાના માર્ગદર્શન પ્રમાણે તૈયાર થયેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનો 'મૂર્તિ પ્રાપ્ત પ્રતિકા મહોત્સવ' (તા. ૨ થી ૬-૨-૨૦૧૨)



જૂનાગઢ પ્રદેશના પાતાપુર (તા. રિના) ગામને આંગણે પ.પૂ. લાલજી મહારાજશ્રીના સાંનિધ્યમાં યોજાયેલ જૂનાગઢ મંદિરના યેરમેનશ્રી પૂ. શા. સ.ગુ. સ્વામી શ્રી પ્રેમસુરપદાસજ્ઞાના માર્ગદર્શન પ્રમાણે તૈયાર થયેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનો 'મૂર્તિ પ્રાપ્ત પ્રતિકા મહોત્સવ' (તા. ૩૧ થી ૬-૨-૨૦૧૨)



વડતાલ પ્રદેશના પાળજ (તા. પેટલાદ) ગામને આંગણે પ.પૂ. લાલજી મહારાજશ્રીના સાંનિધ્યમાં યોજાયેલ સરધારનિવાસી પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યાવૃપદાસજ્ઞાના માર્ગદર્શન પ્રમાણે તૈયાર થયેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનો 'મૂર્તિ પ્રાપ્ત પ્રતિકા મહોત્સવ' (તા. ૮ થી ૧૪-૨-૨૦૧૨)



સંસ્કૃતાપક ::

આદ્યકા ::

# ચિંતન

વર્ષ :- ૭, અંક :- ૭, તા. ૨૦-૦૨-૧૨

પ્રયોજક ::

પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

પ્રકાશક ::

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્થ શ્રી લક્ષ્મીનારાયણ દેવ  
પીઠસ્થાન સંસ્કૃતાપક - વડતાલ વતી  
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર  
તા.જી. રાજકોટ - ૩૬૦૦૨૫.

તંત્રી : સાધુ પતિતપાવનદાસજી

સંપાદક ::

સ્વામી આનંદસ્વરૂપદાસજી (વેદાંતાચાય)

સંપ્રદાયસ્થ સર્વાર્થી વિકાસ કરતું શ્રી સ્વામિનારાયણ મંદિર -  
સરધારનું રેઝિસ્ટર્ડ મુખ્યપત્ર ઈ.સ. ૨૦૦૫ના જૂન માસથી  
પ્રારંભથેથે, દર માસની ૨૦ તારીખે પ્રકાશિત થતું, આપના  
સમગ્ર કુદુર્ભ-પરિવારમાં આંદ્ર અને સંસ્કારની સૌરભ  
પ્રસરાવે અને જીવનનું અનેંદ્ર ઘડતર કરતું સામયિક.

લવાજમના રૂપ ::

બે વર્ષ	: ₹. ૧૬૦/-
પંચવર્ષિક	: ₹. ૩૫૦/-
પચ્ચીસ વર્ષ	: ₹. ૭૫૦/-
પરદેશમાં લવાજમ	: \$ 200 U.S.A. : £ 100 U.K.

લવાજમદર અંગ ગ્રાહક પત્ર વ્યવહાર ::

'ચિંતન કાર્યાલય'

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર  
તા.જી. રાજકોટ - ૩૬૦૦૨૫. ફોન. ૦૨૮૧ - ૨૭૮૧૨૧૧

Visit us : [www.sardhardham.org](http://www.sardhardham.org)  
[www.swaminarayanaadtalgadi.org](http://www.swaminarayanaadtalgadi.org)  
E-mail : [chintansardhar@yahoo.in](mailto:chintansardhar@yahoo.in)  
[sardhardhamandir@gmail.com](mailto:sardhardhamandir@gmail.com)



"નચિકેતાની પિપાસા, એકલયની જિજ્ઞાસા, અર્જુનની એકાગ્રતા,  
વાણીએની સમાન સંસ્કૃતિ પ્રાચ્યોપો પ્રેમ, હિમાલયની શાંતિ, ગંગાની  
પવિત્રતા, ચંદ્રની શીતળતા, સાગરની ગંભીરતા, મેલની અડગતા અને  
ધૂવની સ્થિરતા - આ બધા જ ગુણોનો જેમાં સુભગ સમન્વય છે અને  
શૌર્યવંતી, ગૌરવવંતી, સત્તવવંતી, શીલવંતી અને ખપીરવંતી માતાના  
કૂઝે પ્રાદુર્ભાવ પામેલા વિરલ વિભૂતિ સહજાનંદી સપ્રાટ પ.પૂ. ૧૦૮ શ્રી  
ધર્મકુળ મુગાંદાણ શ્રી નૃગોન્દ્રમસાદજુ મહારાજશ્રીના 'ઉદ્મા જન્મોત્સવે'  
તેઓના શ્રીચરણોમાં જાણાંગ પ્રણામ સહ કોટિ કોટિ વંદના..."

## અનુકૂળધારણા

ગ્રંથ વાંચનાની રીત અને એક મૌલિક ચિંતન


- 1 - સાધુ યોગેશ્વરદાસજી, ગુરુ : પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી
- 2 - સાધુ અમૃતસ્વરૂપદાસજી, ગુરુ : પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી
- 3 - જીવન-કવનમાં ખમીર, ખુમારી ને ખાનદાનીનો સુભગ સમન્વય
- 4 - સાધુ યોગેશ્વરદાસજી, ગુરુ : પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી
- 5 - ગુજરાત ગૌરવ-ગીરનાર એવોર્ડ સમારોહ....
- 6 - સાધુ અમૃતસ્વરૂપદાસજી, ગુરુ : પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી
- 7 - ધર્મકુળ ધેર આનંદ ભયો, જય બોલો બાળલાલજી કી...
- 8 - સાધુ અમૃતસ્વરૂપદાસજી, ગુરુ : પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી
- 9 - પ.પૂ. બાળલાલજી મહારાજશ્રીનો 'નામકરણ સંસ્કાર મહોત્સવ'
- 10 - સાધુ અમૃતસ્વરૂપદાસજી, ગુરુ : પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી
- 11 - સત્સંગ સમાચાર પત્રિકા....
- 12 - સ્વામી ધનશ્યામદાસજી - રધુવીરવારી તથા સાધુ ધર્મવલ્લભદાસજી - સરધાર  
આગામી કથાપારાયણો તથા મહોત્સવો....
- 13 - નવમી શ્રી સ્વામિનારાયણ સ્પેશ્યલ ટ્રેનયાત્રા.....
- 14 - પૂ. લાલજી મહારાજશ્રીનો ઉદ્મો જન્મોત્સવ - ભુપગઢ

- સંકલિત

- સંકલિત

- સંકલિત

- સંકલિત



# શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહિમા

(સનાતન-વૈદિક શાસોના પ્રમાણો સહિત અર્થસ્ભર મહિમા)

## ગ્રંથ વાંચનાની રીત અને એક મૌલિક ગિંતન

- સાધુ યોગેશ્વરદાસજી, ગુરુ : પૂર્ણ સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

આ ‘મહામંત્ર મહિમા’ ગ્રંથનું જ્યાં સુધી સંપૂર્ણ વાંચનન થાય ત્યાં સુધી કોઈપણ નિર્ણય બાંધી લેવાની ઉતાવળ ન કરશો. એટલે કે સાચું શું? - ખોટું શું? એ નિર્ણયને થોડો મુલતવી રાખજો. જ્યારે પૂરેપૂરો આ ગ્રંથ વાંચાય જાય ત્યારે ધર્મશાસ્ક્રમાં જે હડીકત પ્રમાણિક હોય તેના અંગે વિચારજો અને ચિંતન કરજો, એકાદ પેજ વાંચી તેના ઉપર જો વિચાર કરવાનું શરૂ કરશો તો સમજ લેજો મુશ્કેલી જિભી થશે. કારણ કે શક્ય છે કે, શરૂઆતમાં થોડું કઠીન લાગે, પરંતુ સંપૂર્ણ ગ્રંથ વાંચાય પછી સમજવાની કોશિશ કરશો તો શક્ય છે કઠીનાય જતી રહેશે.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો હડીકત સાચો સિદ્ધાંત સમજવો અતિ કઠીન છે અને આપણી સમજ એટલી નાની છે કે આપણે જ્યારે તેના આધારે નિર્ણય કરી લઈએ છીએ, ત્યારે આપણે હંમેશા ભૂલમાં પડી જઈએ છીએ. માટે ઉતાવળે નિર્ણય ન કરશો, વિચારવા માટે ઘણો સમય છે, ધીમે ધીમે તેના ઉપર વિચારજો.

આપણી આદતો ઘણીવાર ખોટી હોય છે કે, જ્યારે આપણે વાંચન કરતા હોઈએ છીએ, ત્યારે આગળ વાંચેલાનો વિચાર પણ ચાલુ રાખીએ છીએ. તમને ખબર છે? મન એક સમયે એક જ કામ કરી શકે છે, કાં તો વાંચન કરી શકે છે કાં તો વિચાર કરી શકે છે. એટલે જો તમે વિચારશો તો તમે આગળનું વાંચન સંપૂર્ણ નહીં કરી શકો. અને જે વાતને વાંચી જ નથી તો તેના અંગે વિચારી કેવી રીતે કરી શકોઃ? તો પહેલા સંપૂર્ણ વાંચી લો. વિચારવાનું કામ પછી કરી લેજો. કોઈ ઉતાવળ નથી અને અમે એવું પણ નથી કહેતા કે વાંચવાનો અર્થ છે કે માની લેવું - ના. વાંચવાનો અર્થ એવો થતો નથી કે અમે લખીએ તે માની લેવું. પરંતુ જે વાત વાંચી છે તેને શ્રીમદ્ સત્સંગિજીવનાદિક ધર્મગ્રંથોની સાથે સરખાવજો અને જે વાત ધર્મગ્રંથોની સાથે મળતી આવે તેનો વિચાર કરજો, અને પછી તમારો નિર્ણય બાંધજો. માટે પહેલા સંપૂર્ણ ગ્રંથ વાંચવો પચાસ છે. અને વાંચા પછી આ ગ્રંથમાં જો સરચાઈ હશે, તો તે તમારા હદ્ય સુધી પહોંચશે. અને જેના લખાણો ને માન્યતાઓ ધર્મગ્રંથોથી વિજ્ઞાનમાં હશે, તો તે ખોટા હોવાનો બોધ-અનુભવ પણ તમને થઈ જશે.

અને હવે એથીયે વિશેષ મહત્વની વાત અમે તમને કહીએ છીએ કે, અહીની ચર્ચામાં અમારો કેવળ એક ટકા જેટલો જ હિસ્સો છે, નવ્વાણું ટકા હિસ્સો તમારો છે. આખરે સાચું શું? - ખોટું શું? અના નિર્ણાયક સ્વયં તમે છો. અને જો કોઈપણ વાત ધર્મશાસ્ક્રના પ્રમાણ વગર અથવા ધર્મશાસ્ક્રના વાંચન વગર કેવળ મનથી કે દેખાએખીથી સાચી માની લીધી હશે તો આ ગ્રંથ વાંચા પછી તમે અવશ્ય દ્વિધામાં પડશો. ત્યારે આ ગ્રંથમાં જે જે ગ્રંથોના પ્રમાણો તે શ્લોકીની સંખ્યાએ સહિત આપ્યા છે તે ગ્રંથો જો તમારી પાસે હોય

તો તે પ્રમાણ આપેલા શ્લોકની સંખ્યાનો કમ તમારી પાસે રહેલા ધર્મગ્રંથોમાંથી શુદ્ધી ફરી વાર વાંચજો. અને પ્રમાણ આપેલા ધર્મગ્રંથો જો નહોય તો મંગાવીને વાંચજો. તો તમને સત્ય હડીકતની જાણ થશે અને તમારી દ્વિધાપણ દૂર થશે.

પરંતુ આપણી મોટામાં મોટી મુસીબત એ છે કે ધર્મગ્રંથોને વાંચ્યા વગર કોઈપણ જોરથી કહી દે તો તેની ઉપર વિશ્વાસ મૂકી દઈએ છીએ. આપણને કોઈપણ વાતમાં વિશ્વાસ ધરાવતા કરી શક્ય છે. પ્રત્યેક માણસની હાલત પણ એવી જ છે. એ પણ જાણો છે કે આ બિલકુલ જૂદું છે. પરંતુ તેમ છતાં અસત્યને પણ ઘણા દિવસો સુધી અનેક લોકો દ્વારા દોહરાવવાથી તે સત્ય જેવું લાગવા માંડે છે.

એડોલ્ફ હિટલરે પોતાની આત્મકાર્યામાં લખ્યું છે :- “એવું કોઈ જૂઠાણું નથી જેને વારંવાર દોહરાવવામાં આવે તો તે પ્રજા માટે સત્ય ના બની જાય.” આગળ તેણે લખ્યું છે કે, “આ હું કેવળ વાત કે સિદ્ધાંત નથી કહી રહ્યો. આ હું મારા પોતાના અનુભવના આધારે કહું છું. હું સતત કોણ જાણો કેટલા પ્રકારના જૂઠાણાઓ બોલ્યો હોઈશ. પરંતુ યોગ્ય રીતે તેનો પ્રચાર કર્યો, લોકોને સમજાવ્યા અને તે બધા સત્ય બની ગયા. હું ખુલ પણ પાછળથી નવાઈ પામી ગયો કે આટલા બધા લોકો જ્યારે માને છે તો તે સાચું જ હશે. મને પણ એવું લાગવા માંડ્યું બલ્કે જૂદું તો હું જ બોલ્યો હતો. જેની શરૂઆત મારાથી જ થયેલી અને હું જાણું છું કે એ હળાહળ અસત્ય વાતો હતી. પરંતુ જ્યારે આખો દેશ માનવા માંડ્યો ત્યારે મને પણ શંકા થઈ કે ક્યાંક હું ભૂલ તો નથી કરી રહ્યો ને! જ્યારે આટલા બધા લોકો માને છે, તો બરાબર જ માનતા હશે.”

‘હું પચ્ચીસમો નીર્યકરણું’ એમ અત્યારે કોઈ કહે તો તેને જેણો ન સ્વીકારે. એવી જ રીતે એક મહિમદ પયગંબર સિવાય બીજી કોઈ વ્યક્તિ કહે કે, ‘હું પયગંબર છું’ તો તેનો મુસ્લિમો ક્યારેય સ્વીકાર નહિ કરે. કારણ કે એમનો એવો મત છે કે અલ્લા એ મોકલેલા મહિમદ પયગંબરે જે કંઈ કહેવાનું હતું તે બધું જ કહી દીધું છે, તો હવે તેમાં કોઈ સુધારો તો કરવાનો નથી. તો શું કામ અલ્લા બીજાને મોકલે?

એક માણસે એવી ઘોષણા કરી કે, ‘હું પયગંબર છું.’ તો તેને બગદાદના ખલીફાએ પકડીને હાજર કર્યો અને કહ્યું : “આ ગાંડિપણ છોડી દે, નહિતર હત્યા સિવાય એનું બીજું કોઈ પરિણામ નહીં આવે. હું તને એક દિવસની મુદત આપું છું.” પછી તેણે જેલમાં પૂરી દેવામાં આવ્યો. અને કહેવામાં આવ્યું કે, “કાલ સવારે હું આવીશ, તું બરાબર વિચારી લો; નહિતર તારી ગરદન કપાયા સિવાય બીજું કંઈ થશે નહીં. તારી વાત ખોટી છે અને કોઈ પોતાને પયગંબર કહે તે વાત અમે સહન કરી શકીએ નહિ. બસ, મહિમદ એક છે અલ્લા અને એક છે તેના રસૂલ મહિમદ. હવે કોઈ બીજું ન



ચાલે. બસ થયું. કામ પૂરું થઈ ગયું. કુરાનમાં જે કંઈ જોઈએ છે તે બધું જ છે. હવે અલ્લાહ પાસેથી કોઈ નવા નવા પુસ્તકો લાવવાની જરૂર નથી.”

પેલા માણસને કેદ કરવામાં આવ્યો. સવારે બાદશાહ ખલીફા તેને મળવા આવ્યા. ખલીફાએ તેને કહ્યું : “મિત્ર ! કંઈ વિચાર્યુ ? વિચાર કર્યો ?” ત્યારે તે માણસ હસવા લાગ્યો, તેણે કહ્યું : “તમે પાગલ છો. તમને શું એ નથી ખબર કે પયંગંબર સામે હંમેશા મુશ્કેલીઓ આવી છે ! તેનાથી કદાપિ એવું સાબિત નથી થનું કે હું પયંગંબર નથી. તેનાથી તો એ જ સાબિત થાય છે કે હું પયંગંબર છું. આવી મુસીબતો તો હંમેશા અગાઉ પણ પયંગંબર પર આવતી રહી છે. પયંગંબરને હંમેશા હેરાન કરવામાં આવ્યા છે. આ તો એક કસોટી છે અને તમે મને જેટલો હેરાન કરશો, એટલું એ જ સાબિત થશે કે હું પયંગંબર છું. અને તમે જો મારી હત્યા કરશો તો તો બસ, કામ થઈ ગયું. પયંગંબરની હત્યા થતી આવી છે. જુઓ, ઈસુ ખિસ્તીને વખસંભ પર ચડાવી દેવામાં આવ્યા હતા. અને સોકેટીસને જે આપવામાં આવ્યું હતું. આવું તો ચાલતું જ રહે છે. તો તમારે જે કરવું હોય તે કરો. આ તો અલ્લાહે મને પહેલેથી જ કહી રાયું હતું કે તને મોકલી રહ્યો છું પણ બાબુ મોટી મુસીબતોનો સામનો કરવો પડશે. બસ, આ મુશ્કેલી સહન કરવાનું શરૂ થઈ ગયું. હવે વાત પાકી થઈ છે કે હું પયંગંબર છું.” પેલા માણસની વાતથી ખલીફા ખૂબ પરેશાન થયો.

એ જ વખતે તે કેદખાનામાં થોડે દૂર અંધારામાં થાંભલા સાથે એક બીજો કેટી બાંધેલો હતો તે ખડખડાટ હસવા લાગ્યો.

ત્યારે ખલીફાએ આકોશથી તેને પૂછ્યું : “તું કેમ હસે છે ?”

પેલા કેટીએ કહ્યું : “જહાંપનાહ ! આ માણસ ખોઢું બોલે છે.”

ત્યારે ખલીફા કહે : “તારીપાસે એ વાતની કોઈ સાબિતી છે ?”

ત્યારે પેલા કેટીએ કહ્યું : “હું પોતે અલ્લાહ છું ને મેં કોઈ પયંગંબરને મોકલ્યા જ નથી. તો આ પયંગંબર કેમ હોઈ શકે ?”

હવે ખલીફા પાસે બીજો સવાલ ઉભો થયો કે, સામે ઉભેલા પયંગંબર સાચા કે થાંભલા સાથે બાંધેલા અલ્લાહ સાચા ?

વાસ્તવમાં બંને ખોટા જ હતા. પરંતુ એમણે જોરશોરથી કરેલા ખોટા એલાનો ખલીફા જેવા બાદશાહને વિચાર કરતા કરી દીધા. દુનિયામાં આવું જ ચાલે છે.

ખોટો માણસ તમામ પ્રકારની કોશિશો કરીને બિલકુલ સાચા માણસ જેવો બની શકે છે એટલું જ નહિ બલ્કે એવું પણ બને કે સાચાને અને ખોટાને પરીક્ષામાં બેસારવામાં આવે તો સાચા નાપાસ થાય, આવું એટલા માટે શક્ય છે. કારણ કે, સાચું સહજ છે તેમાં ભૂલ થવાની સંભાવના છે. પરંતુ ખોટામાં કોઈ ભૂલયુક્ત થઈ જ શકે નહીં. તેનો હિસાબ ગણિત જેવો છે. તેનો તો એક રતી

રતીનો હિસાબ છે.

આવી એકવાર પરીક્ષા લેવાય ચૂકી છે. યુરોપમાં ચાલી ચેપ્લીન નામના ઘ્યાતનામ એક હાસ્ય કલાકાર હતા. આખી દુનિયામાં હજારો-લાખો લોકો તેના ચાહકો છે. ચેપ્લીનનો જન્મદિવસ હતો અને તેના મિત્રોએ તેના જન્મદિવસે એક સમારંભ વિચાર કર્યો ?” ત્યારે તે માણસ હસવા લાગ્યો, તેણે કહ્યું : “તમે પાગલ છો. તમને શું એ નથી ખબર કે પયંગંબર સામે હંમેશા મુશ્કેલીઓ આવી છે ! તેનાથી કદાપિ એવું સાબિત નથી થનું કે હું પયંગંબર નથી. તેનાથી તો એ જ સાબિત થાય છે કે હું પયંગંબર છું. આવી મુસીબતો તો હંમેશા અગાઉ પણ પયંગંબર પર આવતી રહી છે. પયંગંબરને હંમેશા હેરાન કરવામાં આવ્યા છે. આ તો એક કસોટી છે અને તમે જેટલો હેરાન કરશો, એટલું એ જ સાબિત થશે કે હું પયંગંબર છું. અને તમે જો મારી હત્યા કરશો તો તો બસ, કામ થઈ ગયું. પયંગંબરની હત્યા થતી આવી છે. જુઓ, ઈસુ ખિસ્તીને વખસંભ પર ચડાવી દેવામાં આવ્યા હતા. અને સોકેટીસને જે આપવામાં આવ્યું હતું. આવું તો ચાલતું જ રહે છે. તો તમારે જે કરવું હોય તે કરો. આ તો અલ્લાહે મને પહેલેથી જ કહી રાયું હતું કે તને મોકલી રહ્યો છું પણ બાબુ મોટી મુસીબતોનો સામનો કરવો પડશે. બસ, આ મુશ્કેલી સહન કરવાનું શરૂ થઈ ગયું. હવે વાત પાકી થઈ છે કે હું પયંગંબર છું.” પેલા માણસની વાતથી ખલીફા ખૂબ પરેશાન થયો.

ચેપ્લીને વિચાર્યુ કે, હું પણ બીજા નામે ભરતી કેમ ના થઈ જાઉ ? હું પણ ઉમેદવારી નોંધાવી દઈ બીજા નામે. અને હરિફાઈમાં ભાગ લઈ કોને ખબર પડશે ? ત્યાં તો એકથી સો માણસો છે તેમાં હું ખોવાઈ જઈશ. અને પ્રથમ પુરસ્કાર તો મને મળી જ જશો. કારણ કે, હું અસલી ચાલી ચેપ્લીન છું.

તેમણે ખોટા નામે ઉમેદવારી નોંધાવી અને હરિફાઈમાં સામેલ થયા. પરંતુ જયારે હરિફાઈનું પરિણામ આવ્યું ત્યારે મોટી મુશ્કેલી થઈ, તેનો નંબર બીજો આવ્યો. અને પહેલા નંબર ઉપર કોઈ બીજો જ માણસ હતો.

આ અસલી ચાલી ચેપ્લીનને બીજા નંબરનો પુસ્કાર મળ્યો. એ તો પાછળથી ખબર પડી કે ચાલી ચેપ્લીન ખુદ પણ હરિફાઈમાં હતા અને બીજા નંબરે આવ્યો.

આ નકલ આખી દુનિયામાં થઈ રહી છે અને નકલને કારણો જ સાચી વસ્તુ હોવા છતાં જણાતી નથી. એટલે સાચી વસ્તુ જણાવા માટે વિચાર કરવાવાળી આંખ જોઈએ; શોધવાવાળી, વિચારવાળી, ચિંતનકરવાવાળી, ધર્મશાસ્ત્રી પરિશુદ્ધ થયેલી બુદ્ધિ જોઈએ.

આ મહામંત્ર મહિમા ગ્રંથ સાચી વસ્તુ જણાવવા માટે એક માર્ગદર્શકનું કામ પુરુ પાડશે. એવી મને શ્રદ્ધા છે. ખોટી વસ્તુની વિરુદ્ધમાં આ ગ્રંથ તમને એક મૌલિક ચિંતન કરવાનો વિચારવાનો, સાચું શોધવાનો મોકો આપશો. અને જેમના જીવનમાં એવી કોઈ ધરી આવે કે સાચી વસ્તુ મળતા તેઓ જાગી જાય. અને ખુદ પોતે સાચું જાગો ને બીજાને પણ જણાવે. પરંતુ એ જ માણસ જાગી શકે છે જે બરાબર સમજ ચૂક્યો છે કે પોતે સૂતો છે. કારણ કે જેને ભ્રમ છે કે હું જાગ્રત છું. તેને સ્વયં ભગવાન પણ જગાડી શકશે જ શકે નહીં. તેનો હિસાબ ગણિત જેવો છે. તેનો તો એક રતી

સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાચણ પ્રસ્થાપિત અદ્વિતીય, અવસ્થિત

# સોનલવર્ણી આચાર્ય પરંપરા : વૈદિક દટકવિધાન

- સાધુ અમૃતસ્વરૂપદાસજી તથા સાધુ યોગેશ્વરદાસજી, ગુરુ : પૂ. સ. ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી



સર્વાવતારી ભગવાન શ્રીહરિએ પોતાના બંને ભાઈઓના એક-એક પુત્રને દટક લઈને પોતાને સ્થાને આરૂપ કર્યા છે. જેને માટે ઘણા બુદ્ધિજીવીઓ શંકાઓ ઉપસ્થિત કરતા હોય છે. તેને અહીં કેટલાક સાંપ્રદાયિક તેમજ અન્ય ગ્રંથોના સચોટ પુરાવા સાથે દટકવિધાનને સમજ્ઞાએ.

યાજ્ઞવળક્ય સ્મૃતિ કહે છે :- ‘દ્વાયાન્માતા પિતા વા યં સ પુત્રો દત્કો ભવેત् ।’ માતા-પિતાએ પુત્ર વિનાના આર્ય ગૃહસ્થને આપેલા પુત્રને દટક કહેવાય છે. (યાજ્ઞવળક્ય સ્મૃતિ: ૧૨/૧૩૦)

પ.પૂ. ધ.ধુ. આચાર્ય શ્રી ભગવત્પ્રસાદજી મહારાજશ્રી દ્વારા રચિત ‘શ્રીહરિલીલા પ્રદીપ’ ગ્રંથમાં લખે છે:-

‘રાજન् હરિવેદિકમ્ભૂસુરેસ્તત: શાસ્ત્રોદિતં દત્તવિધિं વિધાય સ: ।

માંગલ્યવાદ્યચનિગીતપૂર્વકે જગ્રાહ તૌ ધર્મસુરાડ્વહકસ્મો ॥’

વૈદિક ખ્રાબણ્ણો દ્વારા શાસ્ત્રમાં કહેલો દત્તવિધિ કરીને ભગવાન મહારાજશ્રી ‘શ્રીહરિલીલામૃત’ ગ્રંથમાં પણ કંડારે છે:-

શ્રીહરિએ માંગલ્ય વાજીંત્રોના ધ્વનિ તથા ગીતપૂર્વક ધર્મધૂરાને વહન કરવા યોગ્ય તે બંને અયોધ્યાપ્રસાદ અને રધુવીરને પુત્રપત્રો ગ્રહણ કર્યા. (શ્રીહરિલીલા પ્રદીપ: કિ-૩, અધ્યા.-૮, શલો.-૨૭)

સ.ગુ. શ્રીવાસુદેવાનંદવર્ણી ‘શ્રી સત્સંગિભૂષણ’ ગ્રંથમાં લખે છે: શ્રીહરિ કહે : “હે ભાઈઓ ! તમારા બંનેની હું પ્રાર્થના કરું છું કે, અત્યારે તમો મને પ્રિય એવા તમારા બે પુત્રો દટકપુત્ર વિધાનથી આપો. પછી તેમને મારા સ્થાને સ્થાપન કરીશ.”

બંને ભાઈઓએ એક-એક પુત્ર આપ્યા બાદ ભગવાન શ્રીહરિ, વેદના કુશણ ખ્રાબણ્ણો પાસે વેદોક્ત અનુસાર દટકપુત્ર ગ્રહણવિધિ કરાવતા હતા. અને વાજીંત્રો વગડાવતા હતા તથા મંગળ કાર્યમાં ગાવા યોગ્ય કીર્તનો ગવરાવવા લાગ્યા. (શ્રી સત્સંગિભૂષણ: ૧૮/૫૧-૫૬)

આ જ પ્રસંગને પ.પૂ. ધ.ধુ. આચાર્ય શ્રી વિહારીલાલજી





પ.પુ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આદિશાચાર્ય  
શ્રી રઘુનીતાજુ મહારાજશ્રી



પ.પુ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય  
શ્રી ભગવતપ્રસાદજુ મહારાજશ્રી



પ.પુ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય  
શ્રી વિદ્યારીતાજુ મહારાજશ્રી



પ.પુ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય  
શ્રી બ્રહ્મત્પ્રસાદજુ મહારાજશ્રી

‘ભાઈ બે પુત્ર આપવાવાળા, તેણે પૂજ્યા ગણોશ સુંટાળા;  
પછી શ્રીજીનું પૂજન કીદું, દાન બજેએ પુઅનું દીદું.  
દેવસ્થ ત્વા ભણી મંત્ર નાથ, ગ્રાલ્યા બે દચાપુત્રના હાથ;  
વસ્ત્ર ભૂષણથી શાણગાર્ય, પ્રલુબે નિજ પાસ જોસાર્યા.  
પછી પુત્ર પ્રતિગ્રહ અંગે, કર્યા હોમ આચાર્યે ઉમંગે;  
કરી હોમ સમાપન ત્વાંય, દિદી આચાર્યને દક્ષિણાય.’

(શ્રીહરિલીલામૃત : ૮/૪૬)

વળી, આ જ પ્રસંગને સ.ગુ. શ્રી નિષ્ઠુળાનંદ સ્વામી ‘ભક્તચિંતામણી’ ગ્રંથમાં આલેખે છે :-

‘વળી ધર્મવંશિ દ્વિજ ધીર રે, અવધપ્રસાદ ને રધુનીર રે;  
એઉ દચાપુત્ર છે અમારા રે, તને કર્યા છે ગુરુ તમારા રે.’

(ભક્તચિંતામણી : પ્ર-૧૬૦)

શબ્દરલનમહોદ્ધિ તથા આટેકોશમાં પણ ‘દચાકપુત્ર’નો અર્થ કરેલો છે કે, પુત્ર વિનાના આર્ય ગૃહસ્થે  
ખોળે લીધેલો પુત્ર, આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ (માત્ર સ્વાત્થીત  
ત્યાગીજનોની શિક્ષાને અર્થે ત્યાગ પ્રધાન જીવન-પરાયણ હોવા છતાં) ત્યાગી ન હતા. કારણ કે તેઓના  
જીવનમાં એક પણ એવો ઈતિહાસ નથી કે તેઓએ ભગવાન કપડાને પરિધાન કર્યા હોય. હા, તેઓ સાધુતાએ  
યુક્ત જીવન ચોક્કસ જીવા હતા એમાં નાની, પરંતુ હતા તો પોતે ધર્મચાર્ય. એટલે જ તેઓએ દચાપુત્રો લઈ  
ધર્મચાર્ય પરંપરા જીવા. પોતાના બંને ભાઈઓના હિકરા ખોળે લીધા, દટક લીધા અને પોતે સદ્ગૃહસ્થ  
બ્રાહ્મણે જ ત્યાગીને દીક્ષા આપવાનો અવિકાર છે તેવી વેષ્ણવ સંપ્રદાયની પરંપરાને જીવા. સ્વયં ભગવાન  
શ્રી સ્વામિનારાયણ વડોદરાનાં રાજપંડિતોને કહ્યું છે :-

‘સર્વવૈષ્ણવમાર્ગષુ શિષ્ટાચારશચ તાદૃશः । પ્રવર્તતે સામ્રાત્ં ચ સત્ત્વાદિષુ યુગોચ્ચપિ ॥’

સર્વ વૈષ્ણવ સંપ્રદાયોમાં શિષ્ટાચાર ગૃહસ્થ બ્રાહ્મણને જ ગુરુ બનાવવાનો છે અને આ શિષ્ટાચાર  
સત્યયુગથી લઈ આજ સુધી પણ એજ પ્રમાણે પ્રવર્તતો છે. (શ્રીહરિદિવિજય : ૪૫/૬૫)

ભગવાન શ્રી સ્વામિનારાયણ ‘સામ્રાત્ં’ શબ્દ બોલેલા છે. અર્થાત્ અત્યારે અમે પણ અમારા ભાઈઓના  
પુત્રોને દટક (ખોળે) લઈ સર્વ વૈષ્ણવ સંપ્રદાયના શિષ્ટાચાર પ્રમાણે ગૃહસ્થ બ્રાહ્મણને જ ગુરુ બનાવવા આ  
વૈષ્ણવ સંપ્રદાયના શિષ્ટાચારને જીવા રાખ્યો છે. એમાં ન્યૂનતા નથી આવી.

આ ઉપરાંત અનેક ધર્મગ્રંથમાં કહ્યું છે કે, ત્યાગી ક્યારેય કોઈનાં પુત્રને દટક ન લઈ શકે. પરંતુ ભગવાન શ્રી  
સ્વામિનારાયણ પોતાના બંને ભાઈઓના પુત્રને દચાવિદિશી લીધેલા છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ  
દચાપિતા હતા. અને દચાપિતાનો અર્થ ભગવદ્ગોમંડલમાં કર્યો છે કે, ‘ધર્મપિતા - અર્થાત્ ધર્મશાસ્ત્રના  
વિધાન મુજબ પિતા કહેવાય છે.’

ત્રિકાળજ્ઞાની બ્રહ્મર્થિ સ.ગુ. શ્રી શતાનંદ સ્વામી સર્વમંગલ સ્તોત્રમાં લખે છે :-

‘દત્તવિદ્યુતાત્સતુદ્વાય નમઃ ।’ - સભામાં જ પોતાના મોટા નાના ભાઈઓ થકી તેમના અયોધ્યાપ્રસાદ  
અને રધુનીર નામના બે પુત્રોને શાસ્કોક્ત દત્તવિદ્યાનથી પોતાના પુત્રપણે ગ્રહણ કરનારા. (૮૩૪)

‘પુત્રવિન્યસ્તગુરુતાય નમઃ ।’ - તે પુત્રને પોતાનું ગુરુપદ આપનારા. (૮૩૫)

‘પુત્રસાકૃતસંશ્રિતાય નમઃ ।’ - સમસ્ત સ્વાત્થીતોને દચાપુત્રાશીન કરનારા. (૮૩૬)

‘પુત્રદત્તમહારીક્ષાય નમઃ ।’ - આચાર્યપદમાં સ્થાપેલા દચાપુત્રોને પોતે જ મહારીક્ષા આપનાર. (૮૮૮)

‘પુત્રવીક્ષિતપુરૂષાય નમઃ ।’ - દીક્ષિત દચાપુત્રો પાસે યથાવિભાગ સ્વ સ્વદેશીય પુરુષોને યથાવિકાર  
સામાન્ય અને વિશેષ દીક્ષા અપાવનારા. (૮૮૯)

‘સુનારીક્ષિતયોષાય નમઃ ।’ - પુત્ર પાસે દીક્ષા દેવડાવેલી તેમની પત્નીઓ (સુનારા-વિરજભાઈ) પાસે  
વિભક્ત સ્વ સ્વદેશીય શ્રીઓને કૃષ્ણાક્ષા અપાવનારા. (૮૯૦)

આ રીતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અણિશુદ્ધ વંશવારસાગત રીતે ચાલી આવતી આચાર્ય પરંપરામાં વિદ્યમાન આચાર્યશ્રી પોતાના યોગ્ય પુત્રને 'ભાવિબાચાર્ય' તરીકે નિમણુંક કરી ભગવાન શ્રીહરિ સ્થાપિત ધર્મધુરા ગાદીસ્થાને આરૂધ કરે છે. અને જો વિદ્યમાનને આચાર્યશ્રીને પુત્ર ન હોય તો વૈદિક પરંપરા અનુસાર દટકપુત્ર તરીકે સ્વીકારીને 'આચાર્યપદ' ની સ્થાપના કરવામાં આવે છે. આથી એ વાત ફિલિત થાય છે કે, વિદ્યમાન આચાર્યશ્રીના વંશવારસાગત પિતા આચાર્યશ્રી હોવા જોઈએ અથવા દટકપિતા આચાર્ય હોવા જોઈએ. જેમ કે:-

(૧) ભગવાન શ્રી સ્વામિનારાયણ - આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના દટકપિતા છે. એટલા માટે આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ 'શ્રીહરિવાક્યસુધાસિંહુ' ગ્રંથની સેતુમાલા ટીકાની સમાનિમાં લખે છે કે:-

'હરિવાક્યસુધાસિંહોષીકેં રચિતા મયા । સેતુમાલાભિધા સમ્યક કૃપયા શ્રીહરિ: પિતુ: ૧૧૧૧'

"શ્રીહરિવાક્યસુધાસિંહુની આ સેતુમાલા ટીકા મારા પિતા એવા શ્રીહરિકૃષ્ણ મહારાજની કૃપાથી લખાયેલી છે."

'ભક્તિર્ધમસુત્સ્તેન શ્રીહરિ: પુરુષોત્તમઃ । ભૂયાદત્પ્રસંત્રો મે પિતા કારુણ્યવારિધિ: ૧૧'

- "આ ટીકા લખવાથી મારા પિતા એવા ધર્મભક્તિના પુત્ર કરુણાનિધિ શ્રીહરિ પૂર્વ પુરુષોત્તમનારાયણ પ્રસંગ થાઓ."

'ઇતિ શ્રીમદેકાન્તિકધર્મપ્રવર્તક શ્રીહર્યકાન્તિકોપાસક શ્રીહરિકૃષ્ણભગવત્સૂનુરધુવીરાચાર્યવિરચિતા  
સેતુમાલાખ્યા શ્રીહરિવાક્યસુધાસિંહુટીકા સમ્પૂર્ણ ૧'

- અને અંતમાં લખે છે : "શ્રીમદ્ એકાંતિક ધર્મપ્રવર્તક શ્રીહરિના એકાંતિક ઉપાસક શ્રીહરિકૃષ્ણ મહારાજના ટીકા એવા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ દ્વારા રચિત સેતુમાલા નામની શ્રીહરિવાક્યસુધાસિંહુની ટીકા સંપૂર્ણ."

'શિક્ષાપની અર્થદીપિકા ભાષ્ય' ગ્રંથની સમાનિમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ લખે છે કે:-

'ઇતિ શ્રીભગવત્સહજાનન્દસ્વામિસુત - શ્રીરઘુવીરાચાર્યવિરચિતં ભાષ્ય સમાપ્તમ: ૧' - ભગવાન શ્રી સહજાનંદ સ્વામિ સૂત આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજશ્રી દ્વારા વિરચિત શિક્ષાપની અર્થદીપિકા ભાષ્ય સમાપ્ત.

(૨) આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે શ્રી ભગવત્પ્રસાદજી મહારાજને દટક તરીકે સ્વીકારી આચાર્યપદે આરૂધ કર્યા હતા. આચાર્ય શ્રી ભગવત્પ્રસાદજી મહારાજ - આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની શિક્ષાપનીનું સંસ્કૃત ભાષ્યની અર્થભોધિની ટીકામાં કહે છે:-

'પુરીકૃત્ય તુ યં નિજે ગુરુપદે સંસ્થાપ્ય સર્વાત્રિજાન્ ભક્તાન્યસ્ય વશે ચકાર સહજાનન્દ: સ સાક્ષાત્કારિ: ।

ભક્તાન્યસ્ય વશે ચકાર સહજાનન્દ: સ સાક્ષાત્કારિ: ।

તસ્ય શ્રીરઘુવીરદેશિકમણે: શ્રીતાત્પાદસ્ય મે, ભૂયાત્વસ્તિકરં પદામ્બુજમિં મૂર્ખો મમાભૂષણમ: ૧'

"સાક્ષાત્ શ્રીહરિ સહજાનંદ સ્વામીએ દાતપુત્ર તરીકે સ્વીકારીને પોતાના તમામ આશ્રિતોના ગુરુપદ પર સ્થાપિત કરેલા એવા મારા પિતા દક્ષિણ દેશના શિરમોડ શ્રી રઘુવીરજી મહારાજના ચરણારવિદ મારું કલ્યાણ કરે. જે ચરણારવિદ મારા માથાના આભૂષણ સમાન છે."

'શિક્ષાપની ભાષ્યટીકા' ગ્રંથની સમાનિમાં આચાર્ય શ્રી ભગવત્પ્રસાદજી મહારાજ લખે છે કે:-

'ઇતિ શ્રીરઘુવીરાચાર્યસુત - શ્રીભગવત્પ્રસાદાચાર્યવિરચિતા ભાષ્યટીકા સમાપ્તા ૧' - આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના ટીકા આચાર્ય શ્રી ભગવત્પ્રસાદજી મહારાજશ્રી દ્વારા વિરચિત શિક્ષાપની ભાષ્યટીકા સમાપ્ત.

'ઇતિ શ્રીહરિકૃષ્ણભગવત્સૂન શ્રીરઘુવીરાચાર્યાત્મજ શ્રીભગવત્પ્રસાદાચાર્યવિરચિતે શ્રીસારોપદેશે હિતોપદેશ-શ્રીહરિસ્તુત્યાદિનિરૂપણનામા દશમોઽધ્યાય: ૧'

અર્થ :- એવી રીતે શ્રીહરિકૃષ્ણ ભગવાનના પુત્ર શ્રી રઘુવીરજી મહારાજ તેમના પુત્ર શ્રી ભગવત્પ્રસાદજી મહારાજ તેમણે રચ્યો એવો જે સારોપદેશ તેને વિષે હિતનો ઉપદેશ તથા ભગવાન શ્રીહરિની સ્તુતિ એ



પ.પૂ. ધ.ধુ. ૧૦૦૮ શ્રી આચાર્ય  
શ્રી આનંદપ્રસાદજી મહારાજશ્રી



પ.પૂ. ધ.ধુ. ૧૦૦૮ શ્રી આચાર્ય  
શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી



પ.પૂ. ધ.ধુ. ૧૦૦૮ શ્રી વિદ્યમાન આચાર્ય  
શ્રી અઞ્જનેપ્રસાદજી મહારાજશ્રી



પ.પૂ. ૧૦૮ શ્રી ધર્મકુળ મુગામણિ  
શ્રી નૃગન્દ્રપ્રસાદજી મહારાજશ્રી

આહિકનું નિરૂપણ કર્યું એ નામે દશમો અધ્યાય જે તે થયો.  
(શ્રીહરિલીલાપત્રીપ: કિ.-૩/૪૪ તથા શ્રી સારોપદેશ - પેજ નં. ૧૮૮, પ્રકાશક: શ્રી સ્વા. મંદિર - વડતાલ, સને ૨૦૧૦)

(૩) આચાર્ય શ્રી ભગવત્પ્રસાદજી મહારાજે શ્રી વિહારીલાલજી મહારાજને દટક તરીકે સ્વીકારી આચાર્યપદ પર આસ્ઠ કર્યા.

- શ્રીહરિલીલામૃત ગ્રંથમાં પ.પૂ. ધ.ধુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રીનો પરિચય આપતા શા. હરિજીવનદાસજી મુખપૃષ્ઠમાં લખે છે :- ‘સનાતનધર્મધૂરંધરાચાર્યશ્રીશ્રીપતિપ્રસાદમહારાજાત્મજ શ્રી આનન્દપ્રસાદચાર્યમહારાજાજ્ઞયા’ - સનાતન ધર્મધૂરંધર આચાર્ય શ્રી શ્રીપતિપ્રસાદજી મહારાજશ્રીના દીકરા શ્રી આનન્દપ્રસાદજી મહારાજની આશાથી. (શ્રીહરિલીલામૃત ભાગ - ૨: મુખપૃષ્ઠ, પ્રકાશક - વડતાલ મંદિર મહંત ધર્મસ્વરૂપદાસજી)

- ‘વ્યાખ્યાત: પ્રીતયે તેષામેષોડદ: કર્તૃસૂનુના । વિહારિલાલચાર્યેણમયા ગુર્જરભાષયા ॥’ અર્થ :- તે સમગ્રની પ્રસંગતાને અર્થે કેતા તેને રજીપાને અર્થે આ ગ્રંથના રચનારા આચાર્ય શ્રી ભગવત્પ્રસાદજી મહારાજ તેમનો પુત્ર શ્રી વિહારીલાલજી નામે આચાર્ય જે હું તે મેં આ સારોપદેશની ગુજરાતી ભાષાએ કરીને વ્યાખ્યા કરી છે. (શ્રી સારોપદેશ - પેજ નં. ૧૮૮, પ્રકાશક: શ્રી સ્વા. મંદિર - વડતાલ, સને ૨૦૧૦)

- ‘તંપ્રપિતામહં નન્તા પિતારં ચ પિતામહમ् । શ્રીહર્યકાંતિકાન્ભક્તાન્સર્વાશ્ચ પ્રણમાસ્યહમ् ॥’ અર્થ :- મારા પ્રપિતામહ જે તે ભગવાન તેમને નમસ્કાર કરીને શ્રીઅયોધ્યાપ્રસાદજી મહારાજ તથા શ્રીરઘૂરીજી મહારાજ તેમને તથા મારા પિતા જે શ્રીભગવત્પ્રસાદજી મહારાજ તેમને તથા સમગ્ર ભગવાન શ્રીહરિના એકાંતિક ભક્તને નમસ્કાર કરું છું. (શ્રી સારોપદેશ - પેજ નં. ૧૮૦, પ્રકાશક : શ્રી સ્વા. મંદિર - વડતાલ, સને ૨૦૧૦)

‘સખી આજ વાત વીતી કહું મારી...’ એ કીર્તનની છેલ્લી પંક્તિમાં લખ્યું છે : ‘રઘુલીર સુત સુતના સ્વામી...’

(૪) શિક્ષાપત્રી (અર્થદીપિકા વ્યાખ્યા અને ભાષ્યટીકા) ગ્રંથમાં પ.પૂ. ધ.ধુ. આચાર્ય શ્રીપતિપ્રસાદજી મહારાજશ્રીનો પરિચય આપતા મુખપૃષ્ઠમાં લખવામાં આવ્યું છે કે :-

‘સનાતનધર્મધૂરંધરાચાર્યશ્રીવિહારીલાલમહારાજાત્મજ શ્રીશ્રી પતિપ્રસાદચાર્યમહારાજાને:’ - સનાતન ધર્મધૂરંધર આચાર્ય શ્રી શ્રીવિહારીલાલજી મહારાજશ્રીના દીકરા શ્રી શ્રીપતિપ્રસાદજી મહારાજનીએ મુંબઈ નિર્ણયસાગર મુદ્રણાલયથી છપાવીને પ્રકાશિત કર્યું છે. (શિક્ષાપત્રી : મુખપૃષ્ઠ, પ્રકાશક - વડતાલ મંદિર આચાર્ય શ્રી શ્રીપતિપ્રસાદજી મહારાજ, સંશોધક : પં. શ્રી કૃષ્ણમાચાર્ય (વડતાલ પાઠશાળા) સને ૧૯૨૪)

- મગનલાલ કીકાભાઈ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ‘નિષ્કુળાનંદ કાવ્ય’ (કીમત - રૂ. ૧) માં આચાર્ય શ્રીપતિપ્રસાદજી મહારાજના ફોટો નીચે લખવામાં આવ્યું છે : ‘ધર્મ ધૂરંધર આચાર્ય શ્રી શ્રીપતિપ્રસાદજી

વિહારીલાલજી મહારાજ.’

(૫) શ્રીહરિલીલામૃત ગ્રંથમાં પ.પૂ. ધ.ধુ. આચાર્ય શ્રી આનન્દપ્રસાદજી મહારાજશ્રીનો પરિચય આપતા શા. હરિજીવનદાસજી મુખપૃષ્ઠમાં લખે છે :-

‘સનાતનધર્મધૂરંધરાચાર્યશ્રીશ્રીપતિપ્રસાદમહારાજાત્મજ શ્રી આનન્દપ્રસાદચાર્યમહારાજાજ્ઞયા’ - સનાતન ધર્મધૂરંધર આચાર્ય શ્રી શ્રીપતિપ્રસાદજી મહારાજશ્રીના દીકરા શ્રી આનન્દપ્રસાદજી મહારાજની આશાથી. (શ્રીહરિલીલામૃત ભાગ - ૨: મુખપૃષ્ઠ, પ્રકાશક - વડતાલ મંદિર મહંત ધર્મસ્વરૂપદાસજી)

(૬) શ્રીહરિલીલામૃત ગ્રંથમાં પ.પૂ. ધ.ধુ. આચાર્ય શ્રી નારેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનો પરિચય આપતા શા. હરિજીવનદાસજી મુખપૃષ્ઠમાં લખે છે :-

‘સનાતનધર્મધૂરંધરાચાર્યશ્રીઆનન્દપ્રસાદમહારાજાત્મજ શ્રીનરેન્દ્રપ્રસાદચાર્યમહારાજાજ્ઞયા’ - સનાતન ધર્મધૂરંધર આચાર્ય શ્રી આનન્દપ્રસાદજી મહારાજશ્રીના દીકરા શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજની આશાથી. (શ્રીહરિલીલામૃત ભાગ - ૧ : મુખપૃષ્ઠ, પ્રકાશક - મુંબઈ મંદિર મહંત ધર્મસ્વરૂપદાસજી)

(૭) નિષ્કુળાનંદ કાવ્ય ગ્રંથમાં તથા ભક્તચિંતામણી ગ્રંથમાં પ.પૂ. ધ.ধુ. આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનો પરિચય આપતા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શા. લક્ષ્મીપ્રસાદદાસજી સ્વામી તથા શા. નીલિકંદાસજી સ્વામી મુખપૃષ્ઠમાં લખે છે :-

‘સનાતનધર્મધૂરંધરાચાર્યશ્રીનરેન્દ્રપ્રસાદમહારાજાત્મજ શ્રીઅજેન્દ્રપ્રસાદચાર્યમહારાજાજ્ઞયા વડતાલમંદિર મુખ્યાધિકરિણા શાસ્ત્રિણા લક્ષ્મીપ્રસાદદાસેન ઓફ્સેટ પ્રોસેસ રૂપેણ પ્રાકાશયં નીતમ્’ (પ્રકાશન : સં. ૨૦૪૦ સને ૧૯૮૪) તથા એ જ રીતે શ્રી સત્યાંગિજીવન, વચ્ચનામૃત વગેરે અનેક ગ્રંથોમાં પણ લખેલ છે.

શ્રી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી (પ્રસિદ્ધ કર્તા : શા. હરિજીવનદાસજી સ્વામી, શ્રી સ્વા. મંદિર ડાકોર)ની અર્પણ પત્રિકા લખે છે :- આચાર્યશ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજની પવિત્ર સેવામાં...

આ રીતે સંપ્રદાયના અનેક ગ્રંથોમાં વિદ્યમાન આચાર્યશ્રીના નામ પાછળ પૂરોક્ત આચાર્યશ્રીનું જ નામ લખવામાં આવ્યું છે. જે આચાર્યશ્રી દટકપિતા હોય કે વંશવારસાગત પિતા હોય શકે છે. ભગવાન શ્રીહરિના સિદ્ધાંત મુજબ વિદ્યમાન આચાર્યશ્રી જ અનુગામી આચાર્યશ્રીની નિમધુંક કરી શકે છે.

● ધર્મકુળ વંશમાંથી શ્રી રઘુલીરજી મહારાજ અને શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને જ કેમ ગાદી ઉપર આઝટ કરી સારાંચ સંમદાયના આચાર્ય તરીકે સ્થાપાય ?

હવે એક પ્રશ્ન એવો પણ ઉદ્ભવે કે શ્રીજીમહારાજે ભૂમંડળ પર વિદ્યામાં જેમનો કોઈ જોટો ન જડે તેવા પરમહંસોમાંથી કોઈને

પોતાના સ્થાને આરૂઢ ન કરતાં શ્રી રધુવીરજી મહારાજ અને શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને જ કેમ ગાઈ ઉપર આરૂઢ કરી સારાંય સંપ્રદાયના આચાર્ય તરીકે સ્થાપા ? તેનો એકજ ઉત્તર છે કે, ૨૬૨ વચ્ચનામૃતોમાં અનેક તાત્ત્વિક પ્રશ્નો પૂછાયા છે. જે પ્રશ્નો સામાન્ય પંડિતોથી તો થવા અશક્ય જ છે. જે પ્રશ્નો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિક સંતોએ કરેલા છે. પરંતુ વચ્ચનામૃતોમાં જેટલાં પણ પ્રશ્નો પૂછાયા છે તે પ્રોઠ અવસ્થાએ પહોંચેલા સંતો-હરિભક્તોએ પૂછેલા છે. સારાય સંસારની પરિસ્થિતિ જાળા-માણાયા પછી ઉદ્ભવેલાં પ્રશ્નો સંતો-ભક્તોએ પૂછ્યા છે. અનેક શાસ્ત્રોના અદ્યાત્મન પછી ઉઠેલી શંકાઓના સમાધાન માટે પ્રશ્નો પૂછાયા છે, પરંતુ ૨૬૨ વચ્ચનામૃતોમાં પૂછાયેલા તમામ પ્રશ્નો પૈકી ફક્ત ૪ પ્રશ્નો બાકાત છે. જે ગઢા મધ્ય પ્રકરણના ૬ માં વચ્ચનામૃતમાં તથા ગઢા અંત્ય પ્રકરણના ૧૪ અને ૧૮ માં વચ્ચનામૃતમાં આદિઆચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ અને આદિઆચાર્ય શ્રી રધુવીરજી મહારાજ દ્વારા પૂછવામાં આવ્યા છે.

**ગઠા મધ્ય પ્રકરણના ૬૮માં વચ્ચનામૃતમાં અયોધ્યાપ્રસાદજી મહારાજે શ્રીજામહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે,** “આ સંસારને વિષે એથે પુરુષ હોય જે આડો પહોર તો સંસારની વિટબણાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય અને તે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો હોય, ત્યારે તે ભજને કરીને તેણે દિવસ બધામાં પાપ કર્યું તે બણે કેનબળે ?”

એ પછી રધુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે, “હે મહારાજ ! આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય છે ?”

આ પ્રશ્નો પૂછીતી વખતે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની ઉંમર ૧૬ વર્ષની અને શ્રી રધુવીરજી મહારાજની ઉંમર ૧૩ વર્ષની હતી. હવે ૧૬ વર્ષના અને ૧૩ વર્ષના કિશોરને આવી મોક્ષની અને ભગવદ્ગ્રામિની તીવ્ર જંખના ભાગ્યે જ જોવા મળતી હોય છે. અને આવા મોક્ષ ઉપયોગી પ્રશ્નો હથયમાં ઉદ્ભવતાં હોય છે. કેટલી પરમાત્માને પ્રાપ્ત કરવાની આતુરતાં અને ભજન કરવાની જંખના હશે ત્યારે આવા પ્રશ્નો આટલી નાના વિષે તેમના અંતરમાં ઉઠ્યાં હશે !!!

વળી, ગઠા અંત્ય પ્રકરણના ૧૪માં વચ્ચનામૃતમાં શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે પૂછ્યું કે, “એકની તો બુદ્ધિ પણ ઘણી હોય, ને શાસ્ત્રમાં પણ બહુ દિષ્ટિ પુગતી હોય અને બીજો છી તેની તો બુદ્ધિ પણ થોડી હોય, ને શાસ્ત્રમાં પણ જાણું જાણતો ન હોય અને ઘણી બુદ્ધિવાળો હોય તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે, અને થોડી બુદ્ધિવાળો હોય તે દફ થકો સત્સંગમાં રહે છે તેનું શું કરશા છે ?” આ પ્રશ્ન પૂછીતી વખતે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજની ઉંમર ૧૬ વર્ષની હતી.

**ગઠા અંત્ય પ્રકરણના ૧૮માં વચ્ચનામૃતમાં શ્રી રધુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે,** “જેવી જગત અવસ્થાને વિષે જીવની સ્થિતિ

છે તેવી સ્વપ્ન અવસ્થાને વિષે કેમ રહેતી નથી ?” આ પ્રશ્ન શ્રી રધુવીરજી મહારાજે ૧૬ વર્ષની વિષે પૂછ્યો હતો.

આટલી નાની વયમાં આટલાં બધા આંતરિક દોષો તરફ જાગૃત વર્તતા અને તેમને ટાળવા માટે સતત પ્રયત્નશીલ રહેનારા આ બંને આચાર્યશ્રીઓને શ્રીજામહારાજે સારાંય સંપ્રદાયના ગુરૂપદે સ્થાપા હતા, તે નિર્વિવાદ વાત છે.

હવે આપણો અહીં આચાર્ય શ્રી રધુવીરજી મહારાજ તથા આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજના ગુણોનું વર્ણન કરતા સંદર્ભોને જોઈશું :

શ્રી અયોધ્યાપ્રસાદજી અને શ્રીરધુવીરજીને ધર્મમાર્ગમાં દંડ અને ધીર-ગંભીર જોયા. તેથી શ્રીહરિના દિલમાં ઈચ્છા થઈ અને તે બંનેને દાટક પુત્ર કર્યા. (શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર - ૧, તરંગ - ૨)

અયોધ્યાપ્રસાદજી અને રધુવીરજી બંને શ્રીહરિના દાટક પુત્ર સુખના ધામરૂપ છે. (શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર - ૧, તરંગ - ૪)

અયોધ્યાપ્રસાદજી અને રધુવીરજી, બંને ઘણા સુધુ હતા. તે શ્રીહરિના દાટપુત્ર હતા અને તેમના ઉપર સ્વામી (મુક્તાનંદ સ્વામી)ને ઘણું હેત હતું. (શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર - ૧૧, તરંગ - ૧)

અયોધ્યાપ્રસાદજી અને રધુવીરજી મારા સંબંધને પામ્યા છે, મારા સંબંધી છે એટલે મને રાજ રાખવા માટે બંનેને મમત્વ રહે. સહૃદી વધારે તાન મને રાજ રાખવાનું હોય છે, છતાં તેમણે કોઈ પણ રીતે ધર્મનો લોપ-ભંગ કરાય નહિ. કારણ કે ધર્મમાં જ બધા અર્થ-પુરુષાર્થ-પ્રયોજનો રહ્યા છે.

(શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર - ૧૧, તરંગ - ૨)

આચાર્ય શ્રી રધુવીરજી મહારાજ ઘણા જ સર્મથ છે. તેમની બુદ્ધિમાં મોક્ષ બાબતનું જ્ઞાન ઘણું જ છે. (શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર - ૧૪, તરંગ - ૧)

ઈચ્છારામજીના પરમ સુધીર પુત્ર રધુવીરજી હતા તે પણ આવી ગયા હતા. રધુવીરજી અને અયોધ્યાપ્રસાદજી બંને સારા સ્વભાવના હતા અને જેણા આવ્યા હતા. શ્રીહરિનિ મરજામાં રહેવાની વાતને અયોધ્યાપ્રસાદજી તથા રધુવીરજી સારી રીતે જાણા હતા અને બીજાને કહેતા હતા. તેણે કરીને તે બંને શ્રીહરિને ગમી ગયા હતા. અને જે આપણો આ સત્સંગ છે તે, તે બંનેનું અતિશય હેત કરનારો હતો. મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને શ્રીહરિએ કહ્યું કે, “આ બંને સત્સંગના મૂળ જેવા છે.” અમારા નાનાભાઈ ઈચ્છારામજી નામે છે. તેના પુત્ર ઉદાર સ્વભાવના રધુવીરજી છે. અયોધ્યાપ્રસાદજી તથા રધુવીરજી, તે બંને મોહ તથા પ્રમાણનો ત્યાગ કરીને અમે જેમ કહીએ તેમ વર્તી રહ્યા છે. (શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર - ૨૮, તરંગ - ૪)

પ.પુ. ધ.ધ. આદિઆર્ય શ્રી રધુવીરજી મહારાજશ્રી તથા પ.પુ. ૧૦૮ શ્રી ધર્મકુળ મુગટમણિ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના

## જીવન-કવનમાં ખમીર, ખુમારી ને ખાનદાનીનો સુભગ સમન્વય

- સાધુ યોગેયરદાસજી, ગુરુ : પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી



પ.પુ. ધ.ધ. ૧૦૮ શ્રી આદિઆર્�ય શ્રી રધુવીરજી મહારાજશ્રી

“...સ.ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામીના કાવ્યમાં જેમ એક પંક્તિ સાથે બીજી પંક્તિનો પ્રાસ મળતો હોય તેમ પ.પુ. આર્ય મહારાજશ્રીની વાણીમાં અને વર્તનમાં એકતા હતી. શબ્દ ઉચ્ચારનારના જીવનમાં જ્યારે આચાર અને વિચારનું સામંજસ્ય રચાય ત્યારે પ્રાણપ્રતિષ્ઠા થાય છે, વાણી દ્વારા જ્યારે ઝત એટલે સત્ય પ્રગતે ત્યારે તે વાણી ઝતંભરા બને છે. બસ, એવી જ રીતે તેઓ શ્રીની ઝતંભરા સભર પ્રતિભા શ્રી સ્વામિનારાયણીય ધર્મકુળને અધિક શોભાયમાન કરે એવી હતી. માટે સ.ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી, આર્યપ્રવર શ્રી રધુવીરજી મહારાજના અક્ષરધામ ગમન બાદ એક વાત કહેતા કે, “મહારાજને અમે અરજી મૂકી છે કે રધુવીરજી મહારાજ જેવા ને આર્ય અને ગયરાજા જેવા એક રાજા મોકલો તો કરોડો જીવાત્માઓ ભગવાન ભજો...” (શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો: ૨/૬૩)

પ.પુ. ધ.ધ. આદિઆર્ય શ્રી રધુવીરજી મહારાજશ્રીના જીવન દ્વારા ચંદનની શીતળતા, સુખદની સુગંધ, પારિજ્ઞતાનો પરિમલ, ગંગાની પવિત્રતા અને રફ્તિકતાની પારદર્શિકતા પ્રગત થઈ આવે છે. કારણ કે, એમના જીવનમાં સનાતન સંમદાચના મૂલ્યો પ્રત્યેની મેરુની અડગતા અને ધૂવની સ્થિરતા જોવામાં આવે છે.

સ.ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામીના કાવ્યમાં જેમ એક પંક્તિ સાથે બીજી પંક્તિનો પ્રાસ મળતો હોય તેમ પ.પુ. આર્ય મહારાજશ્રીની વાણીમાં અને વર્તનમાં એકતા હતી. શબ્દ ઉચ્ચારનારના જીવનમાં જ્યારે આચાર અને વિચારનું સામંજસ્ય રચાય ત્યારે પ્રાણપ્રતિષ્ઠા થાય છે, વાણી દ્વારા જ્યારે ઝત એટલે સત્ય પ્રગતે ત્યારે તે વાણી ઝતંભરા બને છે. બસ, એવી જ રીતે તેઓ શ્રીની ઝતંભરા સભર પ્રતિભા શ્રી સ્વામિનારાયણીય ધર્મકુળને અધિક શોભાયમાન કરે એવી હતી. માટે સ.ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી, આર્યપ્રવર શ્રી રધુવીરજી મહારાજના અક્ષરધામ ગમન બાદ એક વાત કહેતા કે, “મહારાજને અમે અરજી મૂકી છે કે રધુવીરજી મહારાજ જેવા ને આર્ય અને ગયરાજા જેવા એક રાજા મોકલો તો કરોડો જીવાત્માઓ ભગવાન ભજો...” (શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો: ૨/૬૩)

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું એ સદ્ભાગ્ય છે કે, તેનો દિવો જ્યારે જ્યારે જાંખો પડ્યો છે, ત્યારે ત્યારે તેની વાત સંકોરનારા ઉત્તમ પુરુષો સંપ્રદાયને મળતા રહ્યા છે. આપણા સંપ્રદાયના સ.ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી જેવા અનેક મહાપુરુષોએ તપસ્યા દ્વારા અરજીઓ કરી છે, તે વિધાતા ક્યારેય નિષ્ફળ નહિ જ્વા દ..., એટલે તો બરાબર યોગ્ય સમયે જ ભાગ્યવિધાતા સર્વાવત્તારી ભગવાન શ્રી સ્વામિનારાયણે બેભાન પડેલા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને બેઠો કરવા શ્રી ગુણાતીતાનંદ સ્વામીની કરેલી અરજીઓને સાંભળીને વડતાલ દેશના વિઘમાન સમર્થ આર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીને આ પૃથ્વી ઉપર મોકલ્યા અને તેમની પરંપરામાં ‘ધર્મકુળ મુગટમણિ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી’ જેવા મહાન યુગપુરુષોને મોકલ્યા છે. આ સંપ્રદાય પ.પુ. ધ.ધ. ૧૦૮ શ્રી આર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની તથા પ.પુ. અ.સૌ. માતુશ્રીનો ઝાણી રહેશે, કે જેમણે પ.પુ. લાલજી મહારાજશ્રીને દિવ્ય સંસ્કાર અને આદર્શનું પોષણ આપી સંસંગને એક યુગપ્રભાવી મહાપુરુષની ભેટ આપી; જેમણે અનેક કષ્ટ સહન કરીને પણ ધર્મમાર્ગમાં અચળ રહી સત્સંગ જાગૃતિના મહાયશમાં દેહ-ધન-ધામ કુટુંબ પરિવાર સહિત ભગવાન શ્રી સ્વામિનારાયણની સેવામાં સમર્પિત થઈ અનેક મુમુક્ષુઓના હદ્યમાં જ્ઞાનદીપક પ્રગતાવી આ સંપ્રદાયને સુધુમિ અવસ્થામાંથી જગાડવાની ટેક લીધી છે. આજે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને લાલજી શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આદર્શની તાતી જરૂર છે.

પ.પૂ. ૧૦૮ શ્રી ધર્મકુળ મુગટમણિ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષપદ ગઢપુરધામને આંગણે ઉજવાપૈલ આંતરરાષ્ટ્રીય ‘શ્રી સ્વામિનારાચાયા મહામંગ મહોત્સવ’ની પૂર્વસંધ્યા (તા. ૩૦-૧૨-૨૦૧૧) એ તેઓશ્રીના મુખકમળમાંથી નીકળેલા બ્રહ્મવાક્યો કેટલાક મુમુક્ષુ આત્માઓ માટે પ્રેરણાના મંગો સમાન થર્ડ રવા, એ પ્રભ્રાવાક્યો કંઈક આવા હતા:-

હું ફરી ફરીને કહું છું કે, ‘હું હજું થાક્યો નથી, હું હજુ હાયો નથી, હું હજુ થંટ્યો નથી, હું સંપ્રદાયમાં એકેએક ગામડા ઝૂંદી એકેએક હરિભક્તોના ઘેરઘેર જઈ એમને હાથ જોડી જોડીને ભગવાન શ્રી સ્વામિનારાચાયણે સ્થાપેલા સત્ય માર્ગ ઉપર ચલાવવા પડ્શે તો ચલાવીશ.’

આ શબ્દોમાં એને એમના વર્તનમાં સામંજસ્ય જોવા મળે છે. આદિઆચાર્ય શ્રી રધુવીરજી મહારાજ કહેતા કે, “ધર્મની આપણે રક્ષા કરીએ તો ધર્મ આપણી રક્ષા કરે તે આપણે શું ધર્મની રક્ષા કરીએ તો રક્ષા એ જે, મહારાજની આજ્ઞા યથાર્થ પાળવી ને આપત્કાળમાં પણ ફેર પડવા દેવો નહિ...”

(શ્રી રધુવીરજી મહારાજની વાતો : નં. ૨૩)

પ.પૂ. લાલજી મહારાજશ્રીના જીવનમાં પિતામહશ્રીના આ વાક્ય સાર્થક થતાં દેખાય છે.

સૂર્યોદયથી માંડી મોડી રાત્રિ સુધી, દિવાળીથી દિવાળી સુધી... ચોવીસ કલાક... ઉદ્ઘાટન દિવસ સતત કાર્યરત છતાં ભગવાન શ્રીહરિની આજ્ઞા બાબતમાં ક્યારેય એમના જીવનમાં બાંધ્ઘોડ જોવા જ ન મળે.

આદિઆચાર્ય શ્રી રધુવીરજી મહારાજ જેમ અદ્વિતીય સત્સંગની છાવણીઓ, ઉત્સવ-સમૈયાઓના માધ્યમથી સત્સંગમાં નવા પ્રાણ પૂરી પોતાના ગુરુપદની જવાબદારી આબેલુબ અદા કરતા હતા, તેવી જ રીતે તેમની પરંપરાના સર્વે આચાર્યશ્રીઓએ તથા વિદ્યમાન પ.પૂ. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીએ પણ એ જ્યોતને અંદર પ્રજજવલિત રાખી છે.

પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્ડ્રપ્રસાદજી મહારાજશ્રીની નિશ્ચામાં એને તેમના રૂડા આશીર્વાદી પ.પૂ. લાલજી મહારાજશ્રી પણ... કોઈએ ક્યારેય પણ કલ્પના ન કરી હોય એવા અદ્વિતીય આંતરરાષ્ટ્રીય મહા મહોત્સવો દ્વારા તેમજ એમની આજ્ઞાથી વિવિધ સ્થળોએ થતી સત્સંગ છાવણી દ્વારા સત્સંગ-સંપ્રદાયને નવપલ્તવિત રાખી પોતે શ્રી સ્વામિનારાચાયણીય ધર્મહુરા માટે સંપૂર્ણ યોગ્ય છે તેનો પુરાવો આપે છે.

આ ઉપરાંત પ.પૂ. લાલજી મહારાજશ્રીના જીવનમાં અતિ વિષમ પરિસ્થિતિમાં પણ આચાર્યપ્રવર શ્રી રધુવીરજી મહારાજ જેવી જ ધીરજ, ગંભીરતા, સરળતા, દયાળુતા, ઉદારતા એને નિર્દોષિતા જોવા મળે છે.


પ.પૂ. લાલજી મહારાજશ્રી પોતાના અમૃતવચનના ઉપદેશ સમયે સ.ગુ. શ્રી મુક્તાનંદ સ્વામી રચિત પદની આ પંક્તિ લંઘી વખત ઉચ્ચારે છે :- છાંડી કે શ્રીકૃષ્ણાદેવ ઓર કી જો કંઈ સેવ, કારી ડારો કર મેરો તીખી તરવાર સે.’ એ એમની આચાર્ય શ્રી રધુવીરજી મહારાજ જેવી જ સર્વોપરી નિષ્ઠાનો એક નમુનો છે.

પ.પૂ. લાલજી મહારાજશ્રીનો જે મને અતિસમીપથી પરિચય હોય એમના મુખેથી તેઓશ્રીનો મહિમા કહેવાતો હોય એ કદાચ બધુ મોટી વાત નથી. પરંતુ વાત એ મોટી છે કે, જે કોઈ મુમુક્ષુ જીવાત્મા એકવાર એમના દર્શન કરે એ પછી સત્સંગી



પ.પૂ. ૧૦૮ શ્રી ધર્મકુળ મુગટમણિ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી

“આદિઆચાર્ય શ્રી રધુવીરજી મહારાજ જેમ અદ્વિતીય સત્સંગની છાવણીઓ, ઉત્સવ-સમૈયાઓના માધ્યમથી સંપ્રદાયમાં નવા પ્રાણ પૂરી પોતાના ગુરુપદની જવાબદારી આબેલુબ અદા કરી છે, તેવી જ રીતે..., પ.પૂ. લાલજી મહારાજશ્રી પણ, કોઈએ ક્યારેય પણ કલ્પના ન કરી હોય એવા અદ્વિતીય આંતરરાષ્ટ્રીય મહા મહોત્સવો દ્વારા તેમજ એમની આજ્ઞાથી વિવિધ સ્થળોએ થતી સત્સંગ છાવણી દ્વારા સત્સંગ-સંપ્રદાયને નવપલ્તવિત રાખી પોતે શ્રી સ્વામિનારાચાયણીય ધર્મહુરા માટે સંપૂર્ણ યોગ્ય છે તેનો પુરાવો આપે છે.”



હોય કે ન હોય પણ એના મુખેથી પ.પૂ. લાલજી મહારાજશ્રીના પ્રતિ એ જ શબ્દો નીકળે કે, ‘આ કોઈ અદ્વિતીય પુરાષ છે... આ કોઈ ચુગપુરાષ છે.’

નથી લાગતું કે સ.ગુ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીની અરજી સાંભળી શ્રી રધુવીરજી મહારાજ જેવા આચાર્યની કદાચ અક્ષરધામમની સભામાંથી વરણી કરી આ ધરા ઉપર પ.પૂ. ધર્મકુળ મુગટમણિ શ્રી નૃગોન્નત્રપ્રસાદજી મહારાજને મોકલ્યા હોય....!!!

જો જો આપણા પૂર્વજીએ જે ભૂલ કરી તે આપણે ફરીવાર પુનરાવર્તન ન કરીએ તો આપું વાતાવરણ જ લોકોતર (સર્વશ્રેષ્ઠ) અધ્યાત્મવાદના ધબકારે ધબકી રહેલું જણાશે. કારણ કે, સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને નંદસંતોએ ઈતિહાસના પાનામાંથી ચૂંટી કાઢેલી દિવ્ય અણિશુદ્ધ આચાર્ય પરંપરાએ. વિશ્વપ્રેમની જીવંતભાવનામાંથી સ્ફૂરેલી આ અણિશુદ્ધ પરંપરા બસો વર્ષથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોની રોગરગમાં પ્રસરેલી છે. ટેવોને પણ ઈર્ધા આવે એવા અજેય પરાકમો અતિમાનવીય પ્રતિભા અને ઉચ્ચ આધ્યાત્મિકતા આ પરંપરાએ દર્શાવ્યા છે, જે ભાવિને માટે આશા પ્રેરે છે.

આ દિવ્ય આચાર્ય પરંપરાની સુચોગ્ય કદર કરતા જગતને હજુ વાર લાગશે. આ અદ્ભુત યોજનાની સંપૂર્ણ શક્તિની શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો જો પૂરેપૂરી કદર કરી ન

શક્યા તો એ જ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું વિનિપાતનું એકમેક કારણ હશે....!!!!

આચાર્યપદ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની અવચ્છિન્ન પરંપરાને ટકાવી રાખનારું એ પદ છે. ભગવાન શ્રીહરિની કલ્યાણ વ્યવસ્થાની અદ્ભુત એક વ્યવસ્થા છે. આથી જ આચાર્ય સ્થાપનાની પાછળ ભગવાન શ્રી સ્વામિનારાયણની યોજનાનું, ભાવનાનું, વ્યવસ્થાનું એક પ્રચંડ બળ રહેલું છે. આ વાસ્તવિકતાને આપણા સ્વીકાર કે ઈન્કાર સાથે કોઈ જ નિસ્બત નથી. કોઈ સૂર્યના અસ્તિત્વનો ઈન્કાર કરે એટલા માત્રથી સૂર્યના અસ્તિત્વને કોઈ જ નુકસાન પહોંચતું નથી અને એ જ રીતે સૂર્યના અસ્તિત્વનો સૂર્યમુખી કૂલ સ્વીકાર કરે એટલા માત્રથી સૂર્યને કોઈ જ લાભ થઈ જતો નથી. પરંતુ હા એટલું ચોક્કસ બને છે કે સૂર્યના અસ્તિત્વના ઈન્કારથી ધૂવડ સૂર્યના પ્રકાશથી વંચિત રહી જાય છે. અને સૂર્યના અસ્તિત્વનો સ્વીકાર કરવાથી સૂર્યમુખી કૂલ પોતે ખીલી જાય છે. આ વાતની તમને અને મને ખુદને પ્રતીતિ હશે.

કણિયુગના આ બ્યુટીપાલર યુગમાં પ.પૂ. અ.સૌ. માતુશ્રી (ગાદીવાળા) જિંદગીભર ઓઝલ (લાજ) સભર રહેવું એ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની એક અજાયબી છે. એ ઈજિમના પિરામિડો હોય કે આગ્રાનો તાજમહલ હોય, ચીનની જંગી દિવાલ હોય કે પેરીસનો ઢાણો ટાવર હોય, પનામા નહેર હોય કે



પછી લંડનની ભૂગર્ભ રેલ્વે હોય - વિશ્વની અજાયબીઓ તરીકે આ બધું ભલે પેંકાળું હોય, પરંતુ તે તમામ અજાયબીઓને ટક્કર મારે એવી દ્વારીપાલર ચુગમાં જિંદગીભર પ.પૂ. અ.સૌ. માતુશ્રીને ઓગલસભર રહેવું એ વિશ્વની એક સર્વશ્રેષ્ઠ અજાયબી છે.

આજે યુવાન અને યુવતીના પહેરવેશમાં પણ તેમના મનની ઉનમત વાસનાઓ વ્યક્ત રૂપમાં જોવા મળે છે. આ ઈન્ટરનેટ યુગમાં મધ્મી-પણ્ણા, ભાઈ-બહેન, કાકા-કાકી, મામા-મામી, ફઈફ્ફુઝા, ભાઈ-ભાભી, નાના-નાની, સાસુ-સસરા આ બધા જ સંબંધોની દિવાલો બેશરમ થઈને ગેલ્લી છે. ત્યારે પ.પૂ. અ.સૌ. માતુશ્રી પોતાનો ધર્મ સાચવવા ઓજલ સભર ચાર દિવાલો વચ્ચે જીવન જીવી રહ્યા છે - એક ભગવાન શ્રી સ્વામિનારાયણની નિષાના બળથી જ તો. એવી શૌર્યવંતી, ગૌરવવંતી, સત્તવવંતી, શીલવંતી અને ભમીરવંતી માતાના ફૂઝે જ આવા સહજનંદી સમાટ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી જેવા વિરલ વિભૂતિનો જન્મ કે પ્રાહુર્ભાવ થતા હોય છે.

નચિકેતાની પિપાસા, એકલવ્યની જિજાસા, અર્જુનની એકાગ્રતા, વશિષ્ઠની સમાન સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ, હિમાલયની શાંતિ, ગંગાની પવિત્રતા, ચંદ્રની શીતળતા, સાગરની ગંભીરતા, મેરુની અડગતા અને ધ્રુવની સ્થિરતા - આ બધા જ ગુણોને એકત્ર કરીને સર્જનહારે સર્જનના ચાકડે મનોહર મૂર્તિ કંડારી હોય એટલે તો એ મૂર્તિ બિલકુલ આપણા પ.પૂ. લાલજી મહારાજશ્રી જેવી જ હોય કે જેને સર્જન કર્યા બાદ સ્વયં સર્જનહારને પણ ઓવારણા લેવાનું મન થાય એવું છે પ.પૂ. લાલજી મહારાજશ્રીનું આલિજાત્યા. સ્વયં વેદની ઋચાઓ અને ઉપનિષદ્ધના મંત્રો દેહધારણ કરીને ન આવ્યા હોય....!!!

અરે ! વેરી અને વિરોધી પણ જેના વેજા વખાણે એનાથી મોટી

ભિરદાવલી પ.પૂ. લાલજી મહારાજશ્રી માટે બીજી કઈ હોય શકે. જેનામાં ખમીર, ખુમારી ને ખાનદાનીનો સુભગ સમન્વય જોવા મળે છે. જે ભગવાન શ્રી સ્વામિનારાયણના અતિ ઘારા લાડકવાચા લાલ અને આપણા પ્રિયપાત્ર પ.પૂ. લાલજી મહારાજશ્રી માટે બસ એટલું જ કહેવાય :-

‘ઈશ્વરે પણ અણમોલ રતનો, અમુક ભારતમાં બનાવ્યા છે; એ રતનોમાં સહૃથી કિંમતી, નૃગેન્દ્રશ્રી આપણાને મળ્યા છે. આ તો એક પડાવ છે, તમારે આગળ વધતા જવાનું છે; મરણાથી સંતોષ ન કરતા, આખો સાગર પામવાનો છે. નાના શહેરના નાના ઉત્સવ, હવે તમારે મંજિલ નથી; ચૂર્જના કિરણોની જેમ તમારે, દુનિયા પર છવાઈ જવાનું છે.’

આવો, આપણે સહુ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસસ્તાર્થે, અનંત આત્માઓના આત્માંતિક કલ્યાણને અર્થ તેમણે સ્થાપેલા ટિબ્ય સંપ્રદાયના વિકાસમાં પાચાના પદ્ધત તરીકે જેમણે સાક્ષાત્ ભગવાન શ્રીરામચંદ્રજીની માફિક ગાંભીર્યપૂર્ણ અનેકાનેક સદગુણો સહિત પોતાનું જીવન સત્તસંગની સેવામાં સર્વચા સમર્પિત કરેલું છે એવા વડતાલ દેશ ગાદીના આદિઆચાર્ય શ્રી રઘુવીરજુ મહારાજના દ્વિશતાલ્દી કૃતાંજલિ મહોલ્સવ પ્રસંગે... તેમના પ્રત્યે અનંતાનંત કરબધ્ધ-સાસંગ પ્રશામ પૂર્વક કૃતજ્ઞાનાની લાગણી વ્યક્ત કરી કંઈક અંશે પણ ઋણ મુક્ત થવા માટે, તેમની પ્રસસ્તાના પરમપાત્ર અને સદગુણોની મૂર્તિમાન પ્રતિકૃતિ સમાન સાતમા વંશજ પ્રિય પ્રપોત્ર પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી, પ.પૂ. લાલજી મહારાજશ્રી તથા ધર્મકુળ સપરિવારને આપણે ભગવાન શ્રીહરિકૃત મચાદિના પાલનની કટિબદ્ધતાનો વિશ્વાસ આપી એક અણમોલ નજરાણું સમર્પિને જીવનનો ફેરો સાર્થક કરીએ.





બૃહુદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા પ.પૂ.૧૦૮ શ્રી ધર્મકુળ મુગાટમણિ  
નૃગોન્દપ્રસાદજી મહારાજશ્રીને સર્વોચ્ચ ‘ગુજરાતી ગૌરવ એવોર્ડ’થી સન્માનિત

બૃહદ મુખ્ય ગુજરાતી સમાજ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા (૧૨૦ યોજાયો હતો.

જેટલી વિવિધ સંસ્થા સંકલિત) દ્વારા વિવિધ ક્ષેત્રે ઉત્ત્લેખીન્ય પ્રદાન બદલ એવોડ પ્રદાન કરવામાં આવે છે. જેમાં તાજેતરમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ વડતાલ પીઠાવિપતિ વિધમાન પ.પૂ. ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્ડ્રમસાદજુ મહારાજશ્રીના પનોતો સત્પુત્ર અને સુર્યોદયથી

માંડી મોડી રાત્રિ સુધી, ટિવાળીથી ટિવાળી સુધી... ચોવીસ કલાક... ઉદ્પટિવસ આધ્યાત્મિક અને સામાજિક સેવાકાર્યોમાં સતત કાર્યરત રહેતા પ.પુ. ૧૦૮ શ્રી ધર્મકુળ મુગટમણિ શ્રી નૃગોન્દ્રમસાદજુ મહારાજશ્રીની માનવ-સમાજ ઉત્કર્ષની સેવાકાર્યોને બિરદાવતાં બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા સર્વોચ્ચ 'ગુજરાતી ગૌરવ એવોડ' અન્યાયત કરવામાં આવ્યો હતો. આ એવોડ સત્કાર સમારંભ તા. ૨૨-૧-૨૦૧૨ના રોજ સાંજે ૬.૩૦ કલાકે રામલીલા મેદાન, મલાડ (પુરુ) ખાતે

આ પ્રસંગે પ.પૂ. લાલજી મહારાજશ્રી સાથે પૂ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી - સરધાર, પૂ. ચેરમેન સ્વામી - જૂનાગઢ, પૂ. એસ.પી. સ્વામી - ગઢા, પૂ. વક્રિલ સ્વામી - વડતાલ, પૂ. ગોવિંદ સ્વામી - વાયોડિયા વગેરે સંતો તેમજ મુંબઈ પરા વિસ્તારના ભક્તજનો વિશ્વાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

એવોડ સત્કાર સમારંભમાં સૌપ્રથમ મલાડના સંનિષે  
સેવાભાવી ધર્મકુળ આશ્રિત પ.ભ. શ્રી જ્યંતિભાઈ મોદી દ્વારા  
પ.પુ. લાલજી મહારાજશ્રીનું પૃષ્ઠમાળા અર્પણ કરીને સ્વાગત  
કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના  
પ્રમુખ શ્રી હેમરાજભાઈ શાહ અને ટ્રેસ્ટીમંડને વર્ષ - ૨૦૧૧નો  
સર્વોચ્ચ 'ગુજરાતી ગૌરવ એવોડ' પ.પુ. લાલજી મહારાજશ્રીને  
અન્યાયત કર્યો હતો. ત્યારપછી વિવિધ ક્ષેત્રોમાં નિપૂણતા  
ધરાવતા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પ.પુ. લાલજી મહારાજશ્રીના

વરदુહસે સંસ્થા દ્વારા અપાતા ‘ગીરનાર એવોર્ડ’ પ્રદાન કરવામાં આવ્યા હતા.

આમ, ગુજરાતની ધણી બધી પ્રતિભાશાળી, પ્રભાવશાળી વ્યક્તિઓની હરોળમાં આપણા પ.પુ. લાલજી મહારાજશ્રીને સર્વોચ્ચ સ્થાને બિરદાવીને આલોકની પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસિદ્ધ એવોર્ડ પ.પુ. લાલજી મહારાજશ્રીને અર્પણ કરીને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક આધ્યાત્મિક અને સામાજિક સેવાકાર્યોમાં એક મૂલ્યવાન ઈતિહાસ-પૃષ્ઠ ઉમેરાયું છે.

પ.પુ. લાલજી મહારાજશ્રીએ આ એવોર્ડ સ્વીકારતા જણાવ્યું હતું કે, “આ પુરસ્કાર એ કોઈ વ્યક્તિનો પુરસ્કાર નથી, પરંતુ આ પુરસ્કાર એ ગુજરાતની ગૌરવવંતી ધરાનો પુરસ્કાર છે. એ ભૂમિની માટીમાંથી મળોલા સંસ્કાર, સદ્ભાવના અને કલાત્મક પ્રેમભાવનાનો આ એવોર્ડ સમારોહ છે. વૃક્ષના વિકાસનું કારણ ભૂમિમાં રહેલું બીજ છે, તેમ આ સંસ્કારનું કારણ ગુજરાતની ધરા છે. જે ધરા માટે કહેવાયું છે કે ‘જનની જણાતો જણાજે, ભક્ત - દાતા કાં શૂર; નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ તારું નુર...’ જે કલાના ભક્તો હોય, સાહિત્યના ભક્તો હોય કે વિવિધ ક્ષેત્રમાં પારંગત વિષયોમાં એક લગનીથી જયારે કોઈ કાર્ય કરતા હોય ત્યારે તેમની ઉચ્ચ શિખર સર કરવા શક્ય-અશક્ય જેવું રહેલું નથી. પરંતુ સેવાકીય કાર્યો માટે કોઈ સન્માનની અપેક્ષા રાખવી જોઈએ નહિ. પણ છતાંય આ આધ્યાત્મિક-સામાજિક સેવાકીય પ્રવૃત્તિથી એક ગૌરવવંતું ગુજરાત નિર્માણ થાય છે, એક સંસ્કાર નિર્માણ થાય છે.

આજે અમોને જે ગુજરાતી ગૌરવ એવોર્ડ પ્રાપ્ત થયો છે તે બદલ અમારા ઈલ્લદેવ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ અમારા પ.પુ. પિતાશ્રી ધ.ধુ. આચાર્ય શ્રી અજેન્ડ્રપ્રસાદજી મહારાજશ્રી, અમારા પ.પુ. માતુશ્રી અને અમોને સંસ્કાર આપનાર તમામ ગુરુજનોનો અમો હદ્યથી આભાર માનીએ છીએ.

આ ગૌરવ અમારું પોતાનું એકલાનું ગૌરવ નથી. કારણ કે ‘મોર પીછે રણીયામણાં’ તેમ અમારા પીછાં સંપ્રદાયના તમામ આશ્રિત સંતો-ભક્તો છે. તેનાથી આ ગૌરવ અમોને પ્રાપ્ત થયું છે, માટે તમામ આશ્રિતજનોનો અમો હદ્યપૂર્વક આભાર માનીએ છીએ.”



પ.પુ. ૧૦૮ શ્રી ધર્મકુળ મુગટમણિ લાલજી શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના વરદ્દ હસ્તે  
‘ગીરનાર એવોર્ડ’ સ્વીકારતા વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત ગુજરાતી મહાનુભાવો



### સાહિત્ય રલન એવોર્ડ - શ્રી અનિલ જોખી

ગોડલમાં જન્મેલા શ્રી અનિલભાઈ જોખી તેમના કવિપણથી તો વિખ્યાત છે જ, પણ સાથે સાથે તેઓ અનેક મોભાદાર સ્થાનો પણ શોભાવી ચૂક્યા છે. ૧૯૭૭ થી ૧૯૮૭ સુધી તેઓ મુંબઈ મહાનગર પાલિકામાં ભાષા ચિત્રાંશ અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે. ૧૯૮૭માં મુંબઈ મહાનગર પાલિકા દ્વારા તેમનું નાગરિક સન્માન, દિલ્હીમાં સાહિત્ય અકાદમી તરફથી સન્માન, દિવ્ય ભાસ્કર દ્વારા સન્માન અને લાખેણો નરસિંહ મહેતા એવોર્ડ પણ તેમને પ્રામ થયો છે. મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમીના માજુ ઉપાધ્ય અસ્મિતા કાવ્યના ફાઉન્ડેશનના સ્થાપક શ્રી અનિલભાઈ નેશનલ બુક ટ્રૂસ્ટ ઓર્ડિન્યાના તેમજ ભારતીય વિદ્યાભવન મુંબઈના સલાહકાર પણ છે. તેમના ‘બરફમાં પંખી’ અને ‘ઓરા આવો તો વાત કરીએ’ જેવા પુસ્તકો આજે પણ એવા જ લોકપ્રિય છે. જ્યારે સ્ટેચ્યુ, પવનની વાસપીઠ, જળની જન્મોતરી અને રંગસંગ કિાં જેવા નિબંધો, તેમની લેખનકળાની સાક્ષી છે. કવિ તરીકે તેમના ગીતો-કવિતાઓ પણ એટલી જ લોકપ્રિય બની છે.

તેઓના આવા અનેક સાહિત્ય કાર્યોને અનુલક્ષીને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા પ.પુ. લાલજી મહારાજશ્રીના વરદ્દ હસ્તે ૨૦૧૧ વર્ષનો સાહિત્ય રલ ગીરનાર એવોર્ડ અનાયત કરવામાં આવ્યો હતો.

### શ્રેષ્ઠ મ્યુઝિક ડિરેક્ટર એવોર્ડ - શ્રી હિમેશ રેશમીયા

મૂળ મહુવાના અને મુંબઈનગરીમાં સ્થાયી થયેલા વરિષ્ઠ ગુજરાતી મ્યુઝિક ડિરેક્ટર શ્રી વિપીન રેશમીયાના ચિરંજીવી હિમેશ રેશમીયાએ માત્ર ગીતો દ્વારા જ નહીં, પરંતુ મ્યુઝિક, અભિનેતા અને પોઇન્યુસર ક્ષેત્રે પણ એટલી જ નામના મેળવી છે. નાની યુવાન વયે તેમણે ફિલ્મ ફેર એવોર્ડ, જી-સિને એવોર્ડ, આલ્કા એવોર્ડ, યુ.એસ. બોલીવુડ મ્યુઝિક એવોર્ડ, સ્ટાર સ્કીન એવોર્ડ, કોઝી વિથ કરણ બેસ્ટ મેલ એવોર્ડ, મેક્સ સ્ટાર ડસ્ટ એવોર્ડ, એમ ટીવી એમ્ભી એવોર્ડ અને ચેરમેન સુપર સ્ટાર એવોર્ડ વગેરે એવોર્ડો શ્રી હિમેશ રેશમીયાએ મેળવ્યા છે.

શ્રી હિમેશ રેશમીયાએ તેમના સંગીતમાં પદ્ધતિમ અને ભારતની કલા વિકાસ સંગીતનું મિશ્રણ કરી તેમના સંગીતને ચારેબાજુ કષ્ટપ્રિય બનાવ્યું છે. હિમેશ રેશમીયા માત્ર સંગીતકાર કે આલ્બમ બનાવીને બેસી નથી રહ્યા, પરંતુ હજુ તેઓ સંગીત અને અભિનય ક્ષેત્રે નવા નવા સોપાનો સર કરવા સજજ છે.

તેઓના સંગીત ક્ષેત્રેના અનેક સોપાનોમાં બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા પ.પુ. લાલજી મહારાજશ્રીના વરદ્દ હસ્તે ‘શ્રેષ્ઠ મ્યુઝિક ડિરેક્ટર ગીરનાર એવોર્ડ’ અનાયત કરીને વિશેષ સન્માન પ્રામ થયું છે. હસ્તે ૨૦૧૧ વર્ષનો સાહિત્ય રલ ગીરનાર એવોર્ડ અનાયત કરવામાં આવ્યો હતો.





## એન.આર.આઈ. એવોર્ડ - શ્રી વિજય ઠાકોર, હોંગકોંગ

ગુજરાતિઓ માટે એક ગૌરવ લેવા જેવી વાત છે કે, બેંક ઓક અમેરિકાને વિજયભાઈ ઠાકોરની વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક કરી. વિજયભાઈ રિટાઇર થયા ત્યાં સુધી બેંક ઓક અમેરિકાની હોંગકોંગમાં ખાચમાં વાઈસ પ્રેસિડેન્ટ રહ્યા. ૧૯૮૮માં મુંબઈમાં બેંક ઓક ઇન્ડિયામાં જોડાયા બાદ પ્રગતિ કરીને હોંગકોંગમાં બેંક ઓક ઇન્ડિયામાં રહ્યા. ત્યારબાદ ૧૯૮૪માં બેંક ઓક ઇન્ડિયાની હોંગકોંગ ખાચમાં જોડાયા અને ૧૯૮૮ થી ૧૯૯૪ સુધી બેંક ઓક ઇન્ડિયાની હોંગકોંગ ખાચમાં જોડાયા. પરંતુ વિજયભાઈ આજે અટકા નથી, નિરૂપી બાદ વિજયભાઈએ પોતાની પ્રો ટેક ઇન્ટરનેશનલ લિ. કંપની સ્થાપી આ કંપની એચ.આઈ.વી. ડ્રસાનું ઉત્પાદન કરે છે અને સાઉથ આફ્રિકામાં ફી ઇસ્ટ્રીયુશન કરે છે. વિજયભાઈ આ માટે ધનવાન દાનવારો પાસેથી પાસેથી પૈસા મેળવીને જરૂરિયાતોને મદદ કરી તેમની ફેફટરી પણ ચલાવે છે. તેઓએ લાખો રૂપિયાની મદદ લ્યુક્સેન્સ અને હાર્ટ સર્જરી જેવા દર્દીઓને કરી છે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાતમંદીને તેઓ હેલ્પ કરે છે.

શ્રી વિજયભાઈ ઠાકોરના ઉપરોક્ત સેવાકાર્યોથી પ્રમાણિત થઈને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા પ.પૂ. લાલજી મહારાજશ્રીના વરદ્દ હસ્તે 'એન.આર.આઈ. ગીરનાર એવોર્ડ' એનાયત કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

## નાટ્ય રણ એવોર્ડ - શ્રી અરવિંદ રાઠોડ

થિયેટર કે ફિલ્મમાં આવવાની જેમની કોઈ યોજના ન હતી, પરંતુ જ્યારે તેઓને આ ક્ષેત્રમાં તક મળી ત્યારે તુર્ણત જ જરૂરી લઈ અભિનયના અજવાળા પાથર્યા. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સદાભાગ અરવિંદ રાઠોડ છે. અમદાવાદની પોણમાં રમતાં રમતાં મોટા થયા. ગીતો ગાવાના શોખીન અરવિંદ રાઠોડની કારકીર્દી ગુજરાત સમાચારના ફોટો ગ્રાફર તરીકે થઈ હતી. પરંતુ એક.આર. ઈરાનીના અરણા કલા કેન્દ્રમાં નવા નાટકમાં તક મળ્યા બાદ તેમણે પાછું વળી જોયું નથી. તેમને ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આ શ્રેષ્ઠ કલાકાર જીવન હંમેશા પ્રામાણિકતાથી જીવવા માગે છે. ફીટ અને હસમુખા તરોતાજા દેખાતા શ્રી અરવિંદ રાઠોડ નાટકો અને ચિત્રપટમાં કામ કરતા રહેવાનો મંત્ર ધરાવે છે.

અભિનેતા શ્રી અરવિંદ રાઠોડનું બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા પ.પૂ. લાલજી મહારાજશ્રીના વરદ્દ હસ્તે શ્રેષ્ઠ 'નાટ્ય રણ ગીરનાર એવોર્ડ' એનાયત કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.



## નાટ્ય લેખન એવોર્ડ - શ્રી પ્રવિષા સોલંકી

બહુમુખી પ્રતિભા ધરાવતા અને અત્યાર સુધીમાં ૧૮૮૬ થી વધુ નાટકોનું લેખન કરી ચૂકેલા શ્રી પ્રવિષાભાઈ સોલંકી આટલી વિશ્લેષણ સફળતા છાતાં એટલું જ કહે છે કે, 'જીવન એ રીતે જીવવું જોઈએ કે જીણે નાટક ભજવતાં હોઈએ અને નાટક એ રીતે ભજવું જોઈએ કે જીણે જીવન જીવતા હોઈએ.' અને એટલે જ પ્રવિષાભાઈના નાટકોમાં આપણાને માનવજીવનનું પાણું નજરે પડે છે. તેઓ માત્ર નાટક લખીને બેસી નથી રહ્યા, પણ ટીવી. સિરિયલો અને ચિત્રપટમાં પણ તેમણે તેમના કિએટીવ લખાણ દ્વારા સફળતા મેળવી છે. તેમના નાટકોને શ્રેષ્ઠ એવોર્ડ મળ્યા છે. ૧૯૫૭થી તેમની કવિતાથી સર્જન પાત્રી શરૂઆત થઈ અને અત્યારે ૨૦૧૨ માં પણ તેઓ અડીભમ રહીને સર્જન યાત્રાની નાવ હંકારી રહ્યા છે. આ સમય દરમિયાન તેઓ લેખક, હિંદર્શક, કવિ, કલાકાર અને નવલકથાકારના રૂપમાં પણ ખીલી ઉક્ખા છે. આટલી વિશ્લેષણ સફળતા છાતાં પ્રવિષાભાઈ કહે છે કે, ગુજરાતી રંગભૂમિને મેં જે આપ્યું છે તેના કરતા અનેકગણું રંગભૂમિએ મને આપ્યું છે. પ્રવિષાભાઈની સિદ્ધિ દંતકથા સમાન હોવો છીતા એમની સિદ્ધિની નોંધ લેવી જોઈએ એટલી લેવાઈ નથી. પરંતુ બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા પ.પૂ. લાલજી મહારાજશ્રીના વરદ્દ હસ્તે શ્રેષ્ઠ 'નાટ્ય લેખન ગીરનાર એવોર્ડ' એનાયત કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.





## પ્લેબેક સીંગર એવોર્ડ - શ્રી પાર્થિવ ગોહિલ

સ્ટેજ સિંગર, પ્લેબેક સિંગર, મ્યુઝિક કમ્પોઝિટ જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા પાર્થિવ ગોહિલે ગુજરાતી ગાયકી કેને નાની વયે સારી એવી નામના મેળવી છે. જીતીવીના સા રે ગા મા કાર્યક્રમોમાં તેની પ્રતિભા નીખરી ઉઠી અને ‘મેગા ફાઈનલ’માં દ્વિતીય વિનર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું. કલાસિકલ અને પોપ સંગીતના તેઓ ગીતો ખૂબજ પ્રશંસાને પાત્ર બન્યા છે. તેમના ઘેઘૂર અવાજમાં કોઈપણ અક્ષરો જીવંતરૂપ ધારણ કરી નૃત્ય કરવા માંદે છે. શ્રી પાર્થિવ ગોહિલ ભજનો, ગુજરાતી ગીતો, ભગવદ્ગીતાની આઠ સીરી, જૈન સત્વન, શ્રીનાથજ્ઞના પદો તેમજ ક્રીતનોમાં ખીલી ઉક્ખા છે. તેઓને ૨૦૦૬ અને ૨૦૦૮માં ટ્રાન્સ મીડિયાનો બેસ્ટ પ્લેબેક સિંગર એવોર્ડ પ્રાપ્ત થયા છે. અને ૨૦૧૦થી વિન્નો ગુજરાત ગૌરવ એવોર્ડ પણ મળ્યો છે. તેઓના દેશ-વિદેશમાં અનેક સ્ટેજ પ્રોગ્રામોમાં ખૂબજ અનેરી સફળતા મળી છે.

પાર્થિવાયક શ્રી પાર્થિવ ગોહિલની આવી અનેક સિદ્ધિઓમાં એક વિશેષ સિદ્ધિ બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા પ.પુ. લાલજ મહારાજશ્રીના વરદ્દહસ્તે શ્રેષ્ઠ ‘પ્લેબેક સીંગર એવોર્ડ’ એનાયત કરીને આપી છે.

## વ્યાપાર-ઉદ્યોગ એવોર્ડ - શ્રી કાનજીભાઈ રીટા (કેનોરીટા)

કથ્યના વાગડના લોકો જેને પ્રેમથી ‘વાગડની રિઝર્વ બેંક’ કહે છે એવા યુવાશક્તિના જીવલંત ઉદાહરણ સમા અને શાંત શ્રી કાનજીભાઈ રીટાએ આજે ફાયનાન્સના ધ્યાનમાં વિશ્વસનિયતાએ માપદંડ ઊભો કર્યો છે. સ્ટીલલના બજારમાંથી કચ્છી સર્કલ ઊભું કરી તેમના સાથ-સહકારથી શ્રી કાનજીભાઈએ ફાઈનાન્સ બ્રોકીંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ પ્રગતિ સાધીને ‘ઈન્વેન્ચર ગ્રોથ ઓન્ડ સિક્યુરિટીઝ’નામની કંપની સ્થાપી. આજે મુંબઈના નેપિયન્સી રોડ ઉપર ‘કેનોરીટા’ નામનો ધ્યાતનામ ડિપાર્ટમેન્ટ સ્ટોર પણ તેઓ ઊભો કર્યો છે. અને છેલ્લા એક દાયકાથી બિલ્ડિંગ ડેવલપમેન્ટ કેને નામના કાઢી છે. હાલમાં વાગડ વિસા ઓશવાળ મહાજનની ચૂંટણીમાં ઉપમુખ ચૂંટાઈ આવ્યા છે. તેઓ ૨૦૦૮માં કચ્છ-શક્તિનો વ્યાપાર રન એવોર્ડ મેળવી ચૂક્યા છે.

શ્રી કાનજીભાઈ રીટાની ઉપરોક્ત સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા પ.પુ. લાલજ મહારાજશ્રીના વરદ્દહસ્તે શ્રેષ્ઠ ‘વ્યાપાર-ઉદ્યોગ ગીરનાર એવોર્ડ’ એનાયત કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

## વ્યાપાર-ઉદ્યોગ એવોર્ડ - શ્રી મુકેશ ગાલા (નવકાર શ્રુપ)

‘થૂમ લેતી હે કદમ, ખુદ આ કે મંજિલ, અગર ઈન્સાન જો હિંમત ન હારે...’ ખરેખર અત્યારે બિલ્ડિંગ નિર્માણ કેને નામના પ્રાપ્ત કરી રહેલા નવકાર ચુપના શ્રી મુકેશભાઈ ગાલાના જીવનમાં પણ આવું જ બન્યું છે. રેશનિંગની દુકાનમાંથી તેમજ કારિયાણાની દુકાનમાંથી બિલ્ડિંગની લાઈન પકડી સફળતાના શિખરો સર કરવા માટે અનાગ મહેનત અને પરિશ્રમ માગી લે છે ને તે મુકેશભાઈએ કહી બતાવ્યું છે. બોર્ડિંગલીના લિંક રોડ ઉપર નવકાર પ્લાઝાના પ્રોકેક્ટમાં તેમણે આઈ હાર ફૂટની વારી બનાવી છે અને તેમના સમાજના લોકોને એક વર્ષ સુધી કી ઓફ ચાર્ચ આપવાના છે. હાલમાં તેમના શિંપોલી રોડ, પાર્લિયન, ઘાટકોપર અને દાહીસરમાં પ્રોકેક્ટ ચાલી રહ્યા છે. સમાજ માટે આવાસ યોજના કરવી તે તેમની મહત્વાકાંદ્ધા છે. તેઓ કહે છે કે, વાગડ વિશા ઓશવાળ જ્ઞાતિનો એક પણ વ્યક્તિ આવાસ માટે તડપતો ન હોયાં જોઈએ. તેઓ મહાપુરુષોના વિચારોમાંથી પ્રેરણા લઈ જિંડગીની સફર પર પ્રગતિ કરી રહ્યા છે. હિંમત અને ધગશ હોય તો વ્યક્તિ ક્યાંથી ક્યાં સુધી પહોંચે તેનું જીવંત ઉદાહરણ શ્રી મુકેશભાઈ ગાલા છે.

શ્રી મુકેશભાઈ ગાલાના ઉપરોક્ત કાર્યક્રમાંથી પ્રશંસા કરીને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા પ.પુ. લાલજ મહારાજશ્રીના વરદ્દહસ્તે શ્રેષ્ઠ ‘વ્યાપાર-ઉદ્યોગ ગીરનાર એવોર્ડ’ એનાયત કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.



### વ्यापार-ઉद्योग એવोર्ड - શ્રી હિરજુભાઈ રતનશી ગાલા (કિઓન ટેવલપર્સ)

એક માણસ જ્યારે સંખ્યાબંધ ઉદેશો સાથે કામ કરે છે ત્યારે એ વ્યક્તિ જ ખુદ એક સંસ્થા બની જાય છે. બસ, આવું જ કાંઈક શ્રી હિરજુભાઈ ગાલામાં જોવામાં મળે છે. કિઓન ટેવલપર્સના આ માલિકે કિઓન ચુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રોફેક્ટસ હાથ ધર્યા છે. આના કારણે તેમને ઈન્ટિરા ગાંધી પ્રિયદર્શની એવોર્ડ, કન્સ્ટક્રિશન અને ડિઝાઇન એવોર્ડ જેવા કેટલાય એવોર્ડ પ્રાપ્ત થયા છે. છેલ્લા ત્પ વર્ષથી તેઓ કિઓન ચુપ ચલાવી રહ્યા છે. તેઓ રીજનેબલભાવના મકાનો ઊભા કરે છે તેમજ મક્કન્ટાઈલ અને ઈન્ફારાટ્રક્યુર અને સિવિલ કન્સ્ટક્રિશનના કાર્યો કરે છે. અનેક સંસ્થાના સ્થાનક ટ્રસ્ટી, મેમ્બર તરીકે કાર્યરત છે. તેઓ ખાસ કરીને આમ જનતાને પરવર્તે તે માટે તેઓએ કિઓન વેલ્ફર એજયુકેશન ટ્રસ્ટ, યુનિટી એજયુકેશન ટ્રસ્ટના સ્થાપના કરીને ગરીબ હોશિયાર બાળકો જે પ્રાથમિક શિક્ષણથી પણ વંચિત છે તેઓની સહાય કરે છે. તેમજ સુનામી, ધરતીકંપ જેવી કુદરતી આફતોનો ભોગ બન્યા હોય તેઓને તેમજ જુપટપદ્ધી વિસ્તારમાં રહેતા લોકોને શિક્ષણ, તબીબી સારવાર અને વોકેશનલ ટ્રેઈનિંગ રહેતે તેવા કાર્યો કરે છે. આ વેલ્ફર ફાઉન્ડેશન દ્વારા નબળા નાગરિકો, કેદીમાં, રીઓઓ અને બાળકો પણ પરોક્ષ રીતે લાભ છે.

શ્રી હિરજુભાઈ ગાલાની ઉપરોક્ત સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા પ.પૂ. લાલજી મહારાજશ્રીના વરદ્દ હસ્તે શ્રેષ્ઠ 'વ्यાપાર-ઉદ્યોગ ગીરનાર એવોર્ડ' એનાયત કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

### વ्यાપાર-ઉદ્યોગ એવોર્ડ - શ્રી વિશાળ કારીયા (આવિષ્કાર ચુપ)

'ઈસ તરહસે હી હમને કી હે મંજિલે, કી ગિર પડે ગિરકર ઉઠે, ઉઠકર ચલે...' શ્રી વિશાળભાઈ કારીયાના જીવનમાં પણ આવું જ બન્યું છે. માત્ર ૧૦ ધોરણ સુધી ભાડોલા વિશાળ કારીયા પોતાના પિતાના ધંધામાં જોડાયા હતા. પરંતુ ૨૦૦૪માં થોડી રૂકાવટ આવ્યા બાદ ૨૦૦૮માં પુનઃ બિજનેસ લાઈનમાં આવ્યા અને આવિષ્કાર કન્સ્ટક્રિશન અત્યારે પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે.

શ્રી વિશાળભાઈ કારીયાના આ કાર્યને બિરદાવીને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા પ.પૂ. લાલજી મહારાજશ્રીના વરદ્દ હસ્તે શ્રેષ્ઠ 'વ्यાપાર-ઉદ્યોગ ગીરનાર એવોર્ડ' એનાયત કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.



### વ्यાપાર-ઉદ્યોગ એવોર્ડ - શ્રી રામજુભાઈ હરખયંદ શાહ (શાહ હાઉસકોન)

મુખત્વે તો કરિયાણાના વેપારમાં 'શાહ ટ્રેડર્સ' તરીકે વિખ્યાત થયેલા શ્રી રામજુભાઈ શાહ અત્યારે 'શાહ હાઉસકોન પ્રા. લી.' કંપની દ્વારા બિલ્ડિંગ અને ટેવલપર્સના ધંધામાં બૂબજ આગળ વધ્યા છે. અને છેલ્લા ૨૦ વર્ષથી તેમના નાનાભાઈ મનસુખ અથે. શાહ સાથે કાર્યરત છે. શ્રી રામજુભાઈ શાહ વેપાર કે બિજનેસ જ કરીને બેસી નથી રહ્યા, તેઓ હંમેશા સમાજસેવા માટે તત્પર રહ્યા છે અને જરૂરી હોય ત્યાં લોકોને તન-મન-ધનથી મદદ પણ કરે છે.

શ્રી રામજુભાઈ હરખયંદ શાહના આ કાર્યને બિરદાવીને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા પ.પૂ. લાલજી મહારાજશ્રીના વરદ્દ હસ્તે શ્રેષ્ઠ 'વ्यાપાર-ઉદ્યોગ ગીરનાર એવોર્ડ' એનાયત કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.



આજ આનંદ આનંદ રે, આનંદ મારે આંગણીએ;  
બાળલાલજ પધાર્યા રે, આનંદ અમારે આંગણીએ...

ધર્મકુળ ઘેર આનંદ ભયો,  
જય બોલો બાળલાલજુ કી...

ધરતી ધૂળું....!! માનવ બન્યો પાળું....!! દાનવને ઈતરાળું!! દેવો બન્યા અમિત્રાપી....!!

ધોર કળિયુગની પરાકાયાએ પ્રયેક સમાજ-દેશ-પ્રજાના સાહલક વર્તનમાં ભારે પરિવર્તન આવી ગયાનું અનુભવાય છે ત્યારે હૈયું થડકાટ અનુભવે છે. અસ્તિત્વ જોખમાંનું લાગે છે અને હદ્યમાંથી અરેરાટીનો ચિત્કાર સંભાળાય છે.

સ્વાભાવિક રીતે જ આવા દિશાશૂન્ય સમયે માનવીને સૃષ્ટિના સર્જનહાર-પાલનહારની કૃપાદાણિ અને સંરક્ષણ પ્રામિનો મર્મ સમજાય છે.

વિનાશની દિશામાં ઝડપથી આગળ વધી રહેલા આસુરી તત્ત્વો, આ પૃથ્વીને નાણ કરવાના તેમના ખતરનાક ઈરાદાઓમાં સફળ થાય તે પૂર્વે કોઈ એક દેવતિવ્યકૃત મહાપુરુષની, સમયાધીન ઉપાયિઓથી ગ્રસિત-ભાગિત માનવીઓના, સમજાને આવશ્યકતા જાપ્યા છે.

ગુજરાતના બહુ પ્રભાવી અને પ્રસરિત શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સ્થિત સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના આદમાં વંશજ વડતાલ પીઠાવિપતિ વિદ્યમાન પ.પૂ. સનાતન ધ.ধુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્ડ્રપ્રસાદજી મહારાજશ્રીના પનોતા સત્યુત્ર નવમાં વંશજ યુગપ્રભાવી અને પ્રતિભા સંપત્ત લાડિલા લાલ અને લાખો યુવક-હદ્યના ખખકાર પ.પૂ. ૧૦૮ શ્રી ધર્મકૃપ મુગાટમણિ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના ધરે પવિત્ર એકાદશીના પુષ્ય સંયોગે અને સંપ્રદાયના સાતમાં આચાર્ય વિદ્વાન શાનીપુરુષ પ.પૂ. ધ.ধુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના પ્રાદુર્ભાવના શુભ દિવસે તેમજ 'શ્રીહિન્દુકૃષ્ણ' મહારાજ સૂત આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ દ્વિશતાબ્દી કૃતાંજલિ મહોત્સવ' તથા દ્વિતીય ચરણ આંતરરાષ્ટ્રીય 'શ્રી સ્વામિનારાયણ ૭૩૦ કરોડ મહામંત્ર લેખન મહોત્સવ' વર્ષમાં સં. ૨૦૯૮ના પોષ વદ - ૧૧(તા. ૧૫-૧-૨૦૧૨)ના રોજ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શામાં વંશજ આ લોકેને પોતાની આગીવી પ્રતિબાથી પાવન કરવા અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળાભૂત સ્વિદ્ધાંતોની અભિવ્રદ્ધિ કરવા અક્ષરાધામી મહામુકાત પથર્યા છે.

વહેલી સવારે સંસાર સાગરના અનેકવિધ સંયોગોમાંથી આશ્રિતજનોને સાંગ્રોપાંગ ભવપાર ઉતારવાના શુભ સંકલ્પ સાથે જ પ્રગટેલા, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના લાભો હરિભક્તોમાં પ.પૂ. બાળલાલજી મહારાજશ્રીના અવતરણથી સર્જિયેલ એ અદ્ભુત આનંદ વાસ્તવિકતાના રૂપમાં સેંકડો અરમાનોના રશક-સંરશકના રૂપમાં સમાર્થી જોઈ શકાય છે.

સર્વ ધર્મકુળ આશ્રિતજનોને પ.પૂ. ભાગ્યલાલજી મહારાજશ્રીના પ્રાગટ્યની વધામણીની શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન સહ... જય  
શ્રી સ્વામિનારાયણ.

• २९३ •

A decorative horizontal scrollwork border featuring intricate, symmetrical patterns of loops and swirls.



નાનાલાલજી શ્રી પણેંદ્રપ્રસાદજી મહારાજશ્રીના ઘેરે બાળલાલજીનું પ્રાગટ્ય

સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના આઠમા વંશજ વડતાલ પીઠાવિપતિ વિદ્યમાન  
પ.પુ. સનાતન ધ.ধુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્ડ્રપ્રસાદજી મહારાજશ્રીના દ્વિતીય સુપુત્ર પ.પુ.  
નાનાલાલજી શ્રી પૃથ્વેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના થંડે સં. ૨૦૬૮ મહા સુદ- ૬ (તા. ૨૮-૧-૨૦૧૨)ના  
શુભ દિવસે બાળલાલજીશ્રીનું પ્રાગટ્ય થયું છે. એકી સાથે બે બાળલાલજીશ્રીનું પ્રાગટ્ય થતા સમગ્ર  
સત્સંગ સમાજમાં અત્યંત આનંદની લાગણીની અનુભૂતિ થઈ રહી છે. બાળલાલજીશ્રીનું ‘પ.પુ. શ્રી  
દિવ્યજ્ઞેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી’ એવું નામાભિધાન કરવામાં આવ્યું છે.

મંગલ... અભિનંદન... હાર્ટિક વધાઈ... હાર્ટિક વધાઈ... મંગલ... અભિનંદન...

A decorative horizontal scrollwork border at the bottom of the page, featuring intricate black swirling patterns.



શ્રી રધુવીર વાડી - વડતાલને આંગણે પ.પૂ. લાલજી મહારાજશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ઉજવાયેલ  
**પ.પૂ. બાળલાલજી મહારાજશ્રીનો 'નામકરણ સંસ્કાર મહોત્સવ'**



મોરે મંદિર આજ બધાઈ ગાઓ મંગાલ દઈ રે, ભાજે ભાજ બહુત ભાત કા ટોલ, નોભત શહનાઈ રે...

'આજ આનંદ આજ ઉત્સવ આજ મેનોમાં નેહ,  
આજ મારે આંગણે સખી કંચન વરસ્યા મેહ...''

તા. ૩૦-૧-૨૦૧૨, મહા સુદ - ઊંઝ શ્રી રધુવીરવાડી - વડતાલ  
ખાતે પ.પૂ. લાલજી મહારાજશ્રીના સાંનિધ્યમાં પ.પૂ. બાળલાલજી  
મહારાજશ્રીનો 'નામકરણ સંસ્કાર મહોત્સવ' ભારતીય વૈદિક સંસ્કૃતિ  
અનુસાર તેણોશ્રીના પ્રાગટ્યના બારમા દિવસે ભક્તિભાવપૂર્વક  
દીજવાયાં આવ્યો હતો. આજના અવસરનો લાભ લેવા ઊમટેલા  
દેશ-વિદેશના હજારો ભાવિક હરિભક્તોથી સમગ્ર શ્રી રધુવીર વાડી  
પરિસરમાં છલકાતું હતું. સૌના ડેઢે અનેરો આનંદ-ઉમંગ-ઉત્સાહ  
હતો. કારણકે, આજ ભાવિગુરુનું નામાભિધાન થયાનું હતું.  
શુભઘડીએ બંને પૂ. બહેનશ્રીઓ દ્વારા પ.પૂ. બાળલાલજી  
મહારાજશ્રીને શ્રીજમહારાજે સ.ગુ. શ્રી મુક્તાંદ સ્વામીને  
વડોદરામાં શાસ્કોક્ત સમયે આપેલા પ્રાસાદિક ઠાકોરજીના દર્શન  
કરાવ્યા હતા. ત્યારબાદ ધર્મકુળ પરિવારના વડિલ અને પ.પૂ. ધ.ધ.  
૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી આનંદપ્રસાદજ મહારાજશ્રીના નાનાભાઈ  
પ.પૂ. શ્રી રાજેન્દ્રપ્રસાદજ મહારાજે તથા પ.પૂ. ધ.ધ. મહારાજશ્રીના

વેવાઈ શ્રી દ્વિવેદીસાહેબે બાળલાલજશ્રીના ભાલમાં કુમકુમનો  
ચોંદલો કરીને પૂજન કર્યું હતું. ત્યારબાદ પિતાશ્રી પ.પૂ. લાલજી  
મહારાજશ્રી તથા ધર્મકુળ પરિવારના સોની ધનશ્યામભાઈ વડોદરાએ  
બાળલાલજશ્રીને સુવર્ણાબ્લંકારથી સજજ કર્યા હતા.  
ત્યારબાદ પૂ. બાબારાજ શ્રી ઊર્વિશીભાએ બાળલાલજશ્રીને સુંદર  
કલાત્મક પારણિયામાં પદ્ધતાચા હતા. બંને પૂ. બહેનશ્રીઓએ  
બાળલાલજશ્રીનું નામકરણ કર્યું હતું. આ નામકરણની જાહેરાત પ.પૂ.  
લાલજી મહારાજશ્રીએ ઓરડામાંથી બહાર આવીને હરિભક્તની  
વચ્ચે અદિષ્ય ઉત્સાહથી જયઘોષ સાથે કરી હતી. બાળલાલજશ્રીનું  
'પ.પૂ. શ્રી યજોન્દ્રપ્રસાદજ મહારાજશ્રી' એવું નામાભિધાન થયું હતું.  
પ.પૂ. લાલજી મહારાજશ્રીએ નામાભિધાન કર્યું ત્યારે આ અવસરને  
વિશાળ સંયામાં ઉપસ્થિત રહેલ સંતો-હરિભક્તોએ આનંદથી  
વધાવી લીધો હતો. 'પ.પૂ. બાળલાલજી શ્રી યજોન્દ્રપ્રસાદજ  
મહારાજશ્રીની જય...' 'શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય...'  
'ભાવિગુરુની જય...' વગેરે જયનાદોથી સર્વત્ર જયજ્યકારથી  
વાતાવરણ ગુંજું ઉઠ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત રહેલ પૂ. સંતો-





પાર્ષ્વદીએ બાળલાલજીશ્રીના દર્શન-પૂજન કરીને પારણીયે ભાવથી જૂલાવ્યા હતા. બાર દિવસના બાળલાલજીશ્રીની સુંદર મુખાકૃતિ, આજાનબાહુ, પુષ્ટ અને તેજસ્વી કાયા જોઈ સૌંદર્ય દર્શન કરનારા આશ્રમચકિત થતા હતા.

આજની આ નામકરણ સંસ્કાર મહોત્સવની વિશિષ્ટ સભાની શરૂઆત ધર્મકુળ આશ્રિત યુવક મંડળના સાંક્રિંગા યુવકો દ્વારા ‘નરનારાયણ દોઉ પ્રગટ થયે...’ એ સાંક્રિક કીર્તનથી કરવામાં આવી હતી. ત્યારબાદ સભામાં પૂ. વડિલ સંતોબે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જેનો સારાંશ જોઈએ:-

“આજે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના એક-એક આશ્રિતના દિવ્ય અંતરમાં આનંદ વર્તે તેનું કારણ એ છે કે, પવિત્ર એકાદશીના દિવસે ગુરુવારે ‘ભાવિગુરુ’નું આગમન થયું છે. ધર્મકુળને શ્રીઝમહારાજને જેટલા રાજ કરતા આવડે તેટલા કોઈને નથી આવડતા. લાઘો વર્ષોના સુકૃત ઉદ્ઘિત થયા હોય તેને જ આ ધર્મકુળ વંશમાં જન્મ ધારણ કરવાનો અવસર સાંપદે છે. આજે એકીકાર્યે બંને પ.પૂ. લાલજી મહારાજશ્રીને ત્યાં બાળલાલજીનું પ્રાગટ્ય થયું છે, તેથી દરેકના હૈયા આનંદથી નાચી રહ્યા છે. ભગવાન શ્રીહરિ અને ધર્મકુળ પરિવારના શ્રીયરણોમાં પ્રાર્થના કરીએ કે, ભાવિગુરુ શ્રી બાળલાલજી મહારાજશ્રી સંપ્રદાયનું સુકાન સંભાળી સંપ્રદાયમાં ચાર ચાંદ લગાડે અને મહામંત્રને પાંદડે પાંદડે વિસરતો કરી સંપ્રદાયનો વિકાસ કરે...”

- પૂ. સ્વામી શ્રી વિષેકરવરૂપદાસજી - બગાસરા

“આજે શ્રીરધૂવીર વાડી છપૈયાધામ તૂલ્ય બની છે. જે આનંદ ને માણોલ બાળપ્રલૂ શ્રી ધનશ્યામ મહારાજના નામકરણ કરવા માટે માઈય મુનિ પથાર્યા તારે હોતો તેવો જ આનંદ આજે વર્તમાન સમયમાં થઈ રહ્યો છે. પ. પૂ. બાળલાલજી મહારાજશ્રીનું વૃષ્ટિક રશીમાં ‘ધર્મન્પ્રસાદ’ નામ બહુ સાર્થક છે. વશમાં મુખ્ય સ્વરૂપ હોય તે છે પુરુષોત્તમાનારાયણ, અને તેમનું પ્રતિનિધિ કરવા માટે યજોન્પ્રસાદજી મહારાજ પથાર્યા છે. આ ધર્મકુળનું પુરુષોત્તમાનારાયણના હદ્યકમળાંથી પ્રાગટ્ય થયું છે, તેથી આ કુણ સનાતન ધર્મકુળ છે. આજે બાળલાલજી મહારાજશ્રીએ શુભેચ્છા પાઠ્યોએ છીએ કે, ‘જીવો મહા શરદ શતં’ - એમના વચનો, એમના દર્શનો અનંત વર્ષ સુધી સત્તસંગ સમાજને થતાં રહે.’”

- પૂ. શા. સ્વામી શ્રી પ્રેમસ્થરૂપદાસજી (ચેરમેનશી, જૂનાગઢ)

“આજે વર્ષોની પ્રતિકા પછી ભાવિગુરુરૂપે બાળલાલજી મહારાજશ્રીનું પ્રાગટ્ય થયું છે. આજે એક નહિ, બધે બાળલાલજીશ્રીનું પ્રાગટ્ય થયું છે, તેથી સંપ્રદાયના તમામ ધર્મકુળ આશ્રિતજનોમાં અનેરો ઉમંગ છાયાઈ રહ્યો છે. વડતલાવાસી શ્રીહરિકૃષ્ણ મહારાજશ્રીના શ્રીયરણોમાં પ્રાર્થના કરીએ કે, ભાવિઆચાર્ય શ્રી નૃગોન્પ્રસાદજી મહારાજ જેવું સુખ સંપ્રદાયમાં આપી રહ્યા છે તેથી અધિક સુખ આ સંપ્રદાયના સંતોભકતનોને બાળલાલજી શ્રી યજોન્પ્રસાદજી મહારાજશ્રી પ્રદાન કરતા રહે તેવી પ્રાર્થના સહ....”

- પૂ. સ્વામી શ્રી જયોન્પ્રસાદદાસજી - વડતાલ

“પ.પૂ. બાળલાલજીશ્રીના પ્રાગટ્યનો આ આનંદ એકદિવસનો નહિ, પણ વર્ષો સુધીઓ, પેઢીઓ સુધીનો નિર્માણ થઈ રહ્યો છે. અક્ષરધામના અનંત મુક્તોની પ્રાર્થનાથી અને ઉદ્ઘ કરોડ મહામંત્ર લેખન મહોત્સવ અને ત્યારબાદ ઉદ્ઘ કરોડ મહામંત્ર લેખન વર્ષમાં તેમજ શ્રીહરિકૃષ્ણ મહારાજ સૂત આદિઆચાર્ય શ્રી રધૂવીરજી મહારાજ દ્વિશતાણી પ્રાગટ્ય કૃતાંજલિ મહોત્સવ વર્ષમાં અને મહાશાની પુરુષ આચાર્યવર્ષ શ્રી નરેન્પ્રસાદજી મહારાજના પ્રાગટ્યતિથિ એકાદશીના પવિત્ર દિવસે સુભગ સમન્વય સાથે બાળલાલજીશ્રીનું પ્રાગટ્ય થયું છે. પ.પૂ. લાલજી મહારાજશ્રીની અલોકિક કાંતિમાં ‘સોનામાં સુંગય બળો’ તેમ બાળલાલજીશ્રી સંપ્રદાયની સુવાસને વધારવા માટે પથાર્યા છે. ત્યારે આ સંપ્રદાયનું ભાવિ બહુ ઉજ્જવળ દેશ્યમાન થઈ રહ્યું છે. ભગવાન શ્રીહરિના



શ્રીયરણોમાં પ્રાર્થના કરીએ કે, આપે જેવા દિવ્ય સંકલ્પથી નથી, નિર્વિવાદ વાત છે. આજના દિવસે અમો ધર્મકુળ પરિવારના બાળલાલજીશ્રી ભેટ આપ્યા છે ત્યારે તેઓશ્રીના વરદ્ધસે તેવા જિ દિવ્ય કાર્યો થાય અને આ વાતને સત્સંગ સમાજ વહેલીતકે સમજીને આપના ચરણારવેંદ પામી શકે તેવી અભ્યર્થના સહ....”

- પૂ. સ. ગુ. સ્વામી શ્રી નિત્યચયિપદાસજી - સરધાર

“આપું વન ઉત્સવ કરે, જે દિવસ ઊગે ચેંદન જાડ; એ તો પ્રભુનો માની પાડ, સદગુણ એના સાંવરા.” જેમ જંગલમાં એક છોડ ઊગે તો આખા જંગલને આનંદ થાય છે, તેમ આજે ધર્મકુળમાં બે-બે બાળલાલજીશ્રી રૂપી છોડના પ્રાદુર્ભાવથી સમગ્ર સંપ્રદાયમાં આનંદ છાવાઈ ગયો છે. આજે દેશ-વિદેશમાં ધર્મકુળ આચાર્યપદનો જગ્યાકાર વર્તે છે તેમાં વિશેષ વૃદ્ધિ કરવા માટે બાળલાલજીનું પ્રાગટ્ય થયું છે. ભગવાન શ્રીહરિણ શ્રીયરણોમાં પ્રાર્થના કરીએ કે, પ.પૂ. બાળલાલજી શ્રી યેન્નપ્રસાદજી મહારાજશ્રીની બાલ્યાવસ્થા તેઓની પોતાની મસ્તીમાં પ્રસાર કરે તેમજ તેઓ ખૂબ સારો અભ્યાસ કરીને ધુરંઘર વિદ્વાન આચાર્ય પેંકિતમાં સ્થાન પ્રાપ્ત કરે. સાથે આપણા ભાવિઆર્થ શ્રી નૃગોન્પ્રસાદજી મહારાજશ્રીનું સ્વાસ્થ તંહુરસ્ત રાયે. તે માટે સમસ્ત સત્સંગ સમાજ સવિશેષ એક-એક માણા શ્રી સ્વામિનારાયણ મહામંત્ર સમરણ સાથે કરે તેવી નમ્ર વિનિતિ સહ....”

- પૂ. કો. શા. સ્વામી શ્રી ધનશ્યામપત્લદાસજી - ગઠડા

“આજે સંપ્રદાયમાં પ.પૂ. બાળલાલજી મહારાજશ્રીનું પ્રાગટ્ય સમગ્ર સત્સંગ સમાજને આનંદ કરાવવા માટેનું છે. આજે બાળલાલજીશ્રીના દર્શન કરવાનો અવસર મળ્યો ત્યારે તેઓશ્રીમાં સમગ્ર આચાર્ય પરંપરાના દર્શનનો આભાસ થતો હતો. પ.પૂ. બાળલાલજી મહારાજશ્રીની આંખોમાં અનેરી ચમક અને તાકાતના દર્શન થઈ રવા છે. તેઓની મુખાકૃતિમાં અલોકિક પ્રકાશ જોવા મળે છે. દર્શનલાવાની શ્રીહરિણજી મહારાજના શ્રીયરણોમાં પાર્વના કરીએ કે, પ.પૂ. બાળલાલજી મહારાજશ્રી સમસ્ત આચાર્ય પરંપરાથી ચીરિયાતો પ્રેમ આ સત્સંગ સમાજને આપે.”

- પૂ. સ્વામી શ્રી સત્યપકાશાદાસજી (એસ.પી.) - ગઠડા

સભાના અંતમાં પ.પૂ. ૧૦૮ શ્રી ધર્મકુળ મુગટમણિ શ્રી નૃગોન્પ્રસાદજી મહારાજશ્રીએ પોતાના હદ્યની ભાવઓર્મિં-લાગણીની સાથે આશીર્વાદ વરસાવતાં કહ્યું:- “ધર્મકુળ પરિવાર એ કેવળ અમારા કુટુંબજીઓ એટલું જ નહિ, પણ સમગ્ર સત્સંગ સમાજ - સંતો-ભક્તો અમારો પરિવાર છે. આજે તમામ સંતો-હરિભક્તો બાળલાલજીના પ્રાદુર્ભાવની શુભેચ્છા લઈને આવ્યા છે તેને અમો સહદ્ય-સહર્ષ સ્વીકારીએ છીએ. ધર્મકુળ પરિવારના શ્રી રામશરણજી બાપાએ પોતાની ૮ વર્ષની ઉમરે પોતાના યજોપિવેત સંસ્કાર સમયે શ્રીજીમહારાજ પાસે વરદાન માઝ્યું છે કે, ‘હે મહારાજ! અમારા ઉપર રાજ થાય હો તો, એવી કૃપા કરજો કે અમારા કુળમાં કોઈ અધર્મી ને કૃપાત્ર પેદાન થાય.’ ત્યારે શ્રીજીમહારાજે રાજ થઈને પોતે ધારણ કરેલે ઉત્તરી-દોરો રામશરણજી મહારાજને પહેરાવ્યો હતો. અને આજે એ પ્રાસાદિક ઉત્તરી-દોરો અમારી પાસે મોજુદ છે.

આજે ભગવાન શ્રીહરિણે બે-બે લાલજીને ભેટ આપી છે તે કોઈ અક્ષરધામના મહામુક્તનો જન્મ આપ્યો હશે તેમાં કોઈ શંકાને સ્થાન

નથી, નિર્વિવાદ વાત છે. આજના દિવસે અમો ધર્મકુળ પરિવારના વડિલો અને સમસ્ત સંતો-ભક્તો પાસે પ્રાર્થના કરીએ છીએ કે, તમો બધા શ્રીજીમહારાજ પાસે એવી પ્રાર્થના કરજો કે, બાળલાલજીની ભગવાન શ્રીહરિણે પસંદગી કરીને જ મોકલ્યા છે, પરંતુ અમોને એવી સત્મજાને શાંતિન-બળ આપે કે અમો બાળલાલજીને સાચા સંસ્કાર અને સાચી ઉપાસના-ભક્તિ શીખવાડી શકીએ. અમારાથી સત્સંગ કાર્યમાં કોઈ ઉષાપ કે કચાશ રહી ગઈ હોય તો બાળલાલજી દ્વારા એ ઉષાપ કે કચાશન રહે અને સવિશેષ સંપ્રદાય-સત્સંગને સેવા કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણનો રાજ્યો પ્રાપ્ત કરી શકે.

આજે બંને બાળલાલજીની જોડ ધર્મકુળ પરિવારમાં ભેટ આપી છે તે સંપ્રદાયમાં એક સૂચ્યક છે. આજે અમારા દશ હાથ થાય છે, તેથી અમો ભગવાન શ્રીહરિણિની અતિ કૃપાનું આ ફણ માનીએ છીએ.

બાળલાલજીનું નામ ‘યજોન્પ્રસાદજી’ તોનો અર્થ છે કે, જેમ યજમાં અપાતી આદૂતિ તે પરમાત્મા સુધી પહોંચે તેમ બાળલાલજીના માધ્યમથી સંપ્રદાયમાં જે કાંઈ સેવાકાર્યો થાય તે સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, અક્ષરધામમાં રહ્યા થકા સ્વીકાર કરે તેવા શુભઆશયથી બાળલાલજીનું નામકરણ-નામાભિધાન કરવામાં આવ્યું છે.

અમારું અને આચાર્ય શ્રી અજેન્પ્રસાદજી મહારાજશ્રીથી લઈને આદિઆચાર્ય શ્રી રધુવીરજી મહારાજ સુધી તમામ આચાર્યશ્રીઓનું એક સપાનું હતું કે, સંપ્રદાય એક છત્ર નીચે થવો જોઈએ. આજે એ કાર્યની અમિવૃદ્ધિમાં અમારી સાથે બીજા ચાર હાથ જોડાય છે. તેથી હવે સત્સંગના વિકાસકાર્યો કરવા માટે અમો પાછા નહિ પડીએ, તેનો વિશ્વાસ સર્વે ભક્તો રાખ્યો તેવી ભલામણ છે.”

અંતે દેશ-વિદેશથી પથારેલ ધર્મકુળ આશ્રિત ભક્તજનોએ ભગવાન શ્રીહરિણે મહાપ્રસાદનો રસાસ્વાદ માણ્યો હતો.



# ਸਤਿਗੁਰ ਪੰਜਾਬ ਸਮਾਚਾਰ



ਸ਼ਾਸਕ ਮਹਾਂਸਾਹਮਨ ਤਥਾ ਸ਼ਾਸਕ ਸਵੰਧਕਲਾਸ਼ ਤਥਾ ਸਾਡੇ ਧਰਮਵਲਭਾਸ਼


## ਵਾਂਸਖੀਲੀਆ



ਵਡਾਲ ਪ੍ਰਦੇਸ਼ਨਾ ਸ਼੍ਰੀ ਹਰਿਕੁਣ ਮਹਾਰਾਜੀ ਛਤ੍ਰਧਾਇਆਨਾ ਵਾਂਸਖੀਲੀਆ (ਤਾ. ਆਂਧੋ) ਗਾਮਨੇ ਆਂਗਝੇ ਵਡਾਲ ਫੇਸ ਪੀਠਾਖਿਪਤਿ ਵਿਧਮਾਨ ਪ.ਪ੍ਰ. ਸੌਨਾਤਨ ਧ.ਬ੍ਲ. ੧੦੦੮ ਸ਼੍ਰੀ ਆਚਾਰੀ ਸ਼੍ਰੀ ਅਖੇਨਪ੍ਰਸਾਦਜੀ ਮਹਾਰਾਜੀ ਤਥਾ ਪ.ਪ੍ਰ. ੧੦੮ ਸ਼੍ਰੀ ਧਰਮਕੁਣ ਮੁਗਟਮਣਿ ਲਾਲਜੁ ਸ਼੍ਰੀ ਨ੃ਗੋਨਪ੍ਰਸਾਦਜੀ ਮਹਾਰਾਜੀਨਾ ਰੂਡਾ ਆਥੀਵਾਂਦ ਆਖਾਈ, ਬ੍ਰਲਿਨਿਓ ਪ੍ਰ. ਸ.ਗੁ. ਸ਼੍ਰੀ ਝਾਨਲੁਵਨਾਦਸ਼ੁ ਸ਼ਾਸੀ (ਵਿਰਸਟਵਾਣਾ)-ਨੀ ਅਮੀਟਾਇਥੀ ਤੇਧਾਰ ਥਖੇਲ ਸ਼੍ਰੀ ਸ਼ਾਸਿਨਾਰਾਯਣ ਮੰਦਿਰਨੇ ੧੦ ਵਰ්਷ ਪੂਰුਥ ਥਾਂ ਹੋਥ ਤਾਰੇ 'ਦਾਨਿਦ ਮਹੀਤਸਾ' ਨੂੰ ਤਾ. ੧੩-੧-੨੦੧੨ ਥੀ ਤਾ. ੨੩-੧-੨੦੧੨ ਸੁਧੀ ਭਵਾ ਆਧੋਝਨ ਕਰਵਾਮਾਂ ਹਨ੍ਤੁ. ਆ ਪ੍ਰਸੰਗੇ ਸਰਧਾਰਨਿਵਾਸੀ ਪ੍ਰ. ਸ.ਗੁ. ਸ਼ਾਸੀ ਸ਼੍ਰੀ ਨਿਤਿਸਵਰਣਪਾਦਸ਼ੁਨਾ ਵਕਤਾਪਦੇ ਰਹੀਨੇ ਸ਼੍ਰੀਮਦ ਸਤਿਗੁਰ ਕਥਾਪਾਰਾਯਣ ਰਸਾਨ ਕਰਾਵ੍ਹਨ੍ਹੁ ਹਨ੍ਤੁ. ਤਾ. ੨੦-੨-੨੦੧੨ ਨਾ ਰੋਜ਼ ਪ.ਪ੍ਰ. ਲਾਲਜੁ ਮਹਾਰਾਜੀਨੀ ਭਵਾ ਥੋਂਭਾਯਾਤ੍ਰਾ ਕਾਢਵਾਮਾਂ ਆਵੀ ਹਨ੍ਤੀ. ਆ ਮਹੀਤਸਵਨੋ ਲਾਭ ਲੇਵਾ ਚਰੋਤਰ ਵਿਸ਼ਾਰਨਾ ਭਕਤਜਨੋ ਵਿਖਾਣ ਸੰਖਾਮਾਂ ਉਪਸਥਿਤ ਰਹਿਆ ਹਨ੍ਤਾ.



## મકરપુરા



મકરપુરા (વડોદરા)ને આંગણે પ.પૂ. લાલજી મહારાજશ્રીના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલ શાકોત્સવ તથા એવોર્ડ સત્કાર સમાચાર (૨૩-૧-૨૦૧૨)

## વડોદરા



ગુજરાતી ગૌરવ એવોર્ડ પ્રેસંગે વડોદરાને આંગણે પ.પૂ. લાલજી મહારાજશ્રીના દિવ્ય સાંનિધ્યમાં યોજાયેલ પ્રેસ-મીડિયા પરિષદ (૨૩-૧-૨૦૧૨)

## ખુનવાડ



વડતાલ પ્રદેશના ખુનવાડ (તા. સંપેડા) ગામને આંગણે પ.પૂ. લાલજી મહારાજશ્રીના સાંનિધ્યમાં  
યોજાયેલ સરધારનિવાસી પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના માર્ગદર્શન પ્રમાણે તૈયાર થયેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનો  
'મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ' (તા. ૨૪ થી ૨૮-૧-૨૦૧૨)



યિતન



ફેબ્રુઆરી  
૨૦૧૨

૨૬



## નાંદોલી



વડતાલ પ્રેદેશના નાંદોલી (તા. માતર) ગામને આંગણે પ.પુ. લાલજી મહારાજશ્રીના સાંનિધ્યમાં યોજાયેલ સરધારનિવાસી પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજીના માર્ગદર્શન પ્રમાણે તૈયાર થયેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનો 'મૂર્તિ પ્રાપ્ત પ્રતિકા મહોત્સવ' (તા. ૨૭ થી ૩૧-૧-૨૦૧૨)

## દ્વારકા



તીર્થધામ દ્વારકાને આંગણે યોજાયેલ શ્રી સ્વા. મંદિરમાં વિરાજમાન બાળપ્રભુ શ્રી ધનશામ મહારાજ આદિક દેવોનો વાર્ષિક પાટોત્સવ (૩૧-૧-૨૦૧૨)






## દેયતી



વડતાલ પ્રદેશના દેયતી (તા. માતર) ગામને આંગણે પ.પૂ. લાલજી મહારાજશ્રીના સાંનિધ્યમાં યોજાયેલ સરધારનિવાસી પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજ્ઞના માર્ગદર્શન પ્રમાણે તૈયાર થયેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનો 'મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ' (તા. ૨ થી ૬-૨-૨૦૧૨)

## પાટાજ



વડતાલ પ્રદેશના પાટાજ (તા. પેટલાદ) ગામને આંગણે પ.પૂ. લાલજી મહારાજશ્રીના સાંનિધ્યમાં યોજાયેલ સરધારનિવાસી પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજ્ઞના માર્ગદર્શન પ્રમાણે તૈયાર થયેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનો 'મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ' (તા. ૮ થી ૧૪-૨-૨૦૧૨)



પ.પુ. સનાતન ધ.ধ. ૧૦૦૮ શ્રી ધર્મમાર્ત્ડ, ધર્મકુળ ચુડામણી વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્ડ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પુ. ૧૦૮ શ્રી ધર્મકુળ મુગટમણિ શ્રી નૃગોન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાંદ સહ આશાથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ-વિદેશમાં સુપ્રસિદ્ધ વક્તા પૂ. સ.ગુ. સ્વામી નિત્યસ્વરૂપદાસજીના માર્ગદર્શન પ્રમાણે તેયાર થયેલ

## નૂતન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવો તથા કથાપારાયણોની તિથિ તવારીખ

ક્રમ	તારીખ	તિથિ	વિગત/પ્રતિષ્ઠા	મહોત્સવ કથા સ્થળ
૫.	૨૩-૩-૨૦૧૨ થી ૨૮-૩-૨૦૧૨	ચૈત્ર સુદ - ૧ થી ચૈત્ર સુદ - ૬	શ્રીમદ્ સત્યાંગિજીવન કથા	મુ. કોટડા સાંગાણી તા. જી. રાજકોટ સંપર્ક :- મો. ૮૮૨૫૪૧૬૬૮૮
૬.	૧૫-૪-૨૦૧૨ થી ૨૧-૪-૨૦૧૨	ચૈત્ર વદ - ૮ થી ચૈત્ર વદ - ૩૦	શ્રીમદ્ સત્યાંગિજીવન કથા	મુ. ચિત્રલ તા. જી. અમરેલી સંપર્ક :- મો. ૮૮૨૫૫૪૮૧૫૮
૭.	૨૩-૪-૨૦૧૨ થી ૨૮-૪-૨૦૧૨	વેશાખ સુદ - ૨ થી વેશાખ સુદ - ૮	શ્રી સ્વામિનારાયણ મહોત્સવ	મુ. પીપળવા તા. લાઠી, જી. અમરેલી સંપર્ક :- મો. ૮૮૭૮૩૭૨૩૪૮
૮.	૨૩-૪-૨૦૧૨ થી ૨૮-૪-૨૦૧૨	વેશાખ સુદ - ૨ થી વેશાખ સુદ - ૮	શ્રીમદ્ સત્યાંગિજીવન કથા	મુ. કુંભારીયા તા. રાજુલા, જી. અમરેલી સંપર્ક :- મો. ૮૫૭૪૫૫૭૭૫૭
૯.	૩૦-૪-૨૦૧૨ થી ૬-૫-૨૦૧૨	વેશાખ સુદ - ૮ થી વેશાખ સુદ - ૧૫	શ્રી સ્વામિનારાયણ મહોત્સવ	શ્રી સ્વામિનારાયણ ધામ, પેવેલીયન મેદાન, મહુવા સંપર્ક :- મો. ૮૧૨૮૬૮૧૫૧૫ (પા. ખુશાલ ભગત)
૧૦.	૭-૫-૨૦૧૨ થી ૧૩-૫-૨૦૧૨	વેશાખ વદ - ૨ થી વેશાખ વદ - ૮	સુવર્ણ જ્યંતિ મહોત્સવ	મુ. મોટા ભમોદ્રા તા. સાવરકુંડલા, જી. અમરેલી સંપર્ક :- મો. ૮૭૧૪૧૦૮૧૫૬
૧૧.	૧૪-૫-૨૦૧૨ થી ૨૦-૫-૨૦૧૨	વેશાખ વદ - ૮ થી વેશાખ વદ - ૩૦	દ્વિશતાબ્દી કૃતાંજલિ મહોત્સવ - ૫	‘શ્રી રધુવીર ધામ’ કાંદિવલી (મુનાઈ) સંપર્ક :- મો. ૮૨૨૪૧૨૮૦૮૮, ૮૮૨૧૬૪૬૦૭૭
૧૨.	૨૪-૫-૨૦૧૨ થી ૨૭-૫-૨૦૧૨	જેઠ સુદ - ૩ થી જેઠ સુદ - ૬	શ્રી સ્વામિનારાયણ બાળ-યુવા મહોત્સવ	શ્રી સ્વામિનારાયણ મંદિર - સરદાર સંપર્ક :- મો. ૭૬૦૦૦૪૮૫૦૩, ૮૮૭૯૫૪૮૫૦૩

### ભવ્ય શાકોત્સવો ::

જૂનાગઢ : તા. ૧૦-૩-૧૨, શાનીવાર,  
સમય :- સવારે ૮ થી ૧

મોટા ભમોદ્રા : તા. ૧૮-૩-૧૨, રવિવાર,  
સમય :- સવારે ૮ થી ૧

### નૂતન મંદિર ખાતમુહૂર્ત ::

ખરોડ, તા. જી. દાહોદ  
તા. ૮-૩-૧૨, શુક્રવાર,  
સમય :- સવારે ૮ થી ૧

આજે જ આપના ધરમાં વસાવો... પ્રત-ઉત્સવ - ૨૦૧૨/૧૩ નવો નિર્ણય પ્રતો તથા ઉત્સવોનો નિર્ણય અને પંચાગ



❖ સંવત ૨૦૬૮/૬૯નાં પ્રત-ઉત્સવોનો નિર્ણય... ❖ જીહેર રજાઓ, તહેવારો, મહોત્સવો, શ્રીહરિ નવમી, એકાદશીઓ, પૂર્ણિમાઓ... ❖ દીપાવલી, લગ્ન, જનોઈ, વાસ્તુ-કળણ તથા ખાતનાં મુહૂર્તો... ❖ મંદિરોની પ્રતિષ્ઠાતિથિઓ તથા પાટોત્સવની વિગતો... ❖ મુહૂર્ત કેવી રીતે જોશો ? શુભ કાર્યો માટે મુહૂર્તો-વાર-નક્ષત્રો-તિથિઓ, નવજાત શિશુનું નામકર્દ રીતે પાડશો ? રાશિ-અક્ષરો તેની સમજૂતી.... ❖ સૂર્ય-ચંદ્ર ઘણણોની વિગત... ❖ વરસાદનાં નક્ષત્રો અને ચોધીયાં... ❖ દેશ-વિદેશના મુખ્ય મંદિરોનાં સરનામાં તથા ટેલિફોન નંબરો...

પૂ. ધનશ્યામી સ્વામી - મો. ૮૮૨૫૧૩૪૧૦૮ પ.ભ. શ્રી નનુમામા - મો. ૮૦૯૯૨૮૨૮૨૮

યાતો શંકરપરા(બોટાદ)...

પદારો શંકરપરા(બોટાદ)...

વડતાલ પીઠાધિપતિ વિદ્યમાન પ.પૂ. કુ. ૧૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્પ્રસાદજી મહારાજશ્રી તથા  
પ.પૂ. ૧૦૮ શ્રી ધર્મકૃત મુગટમણિ શ્રી નૃગ્રંધપ્રસાદજી મહારાજશ્રીના રૂપ આશીર્વાદ સહ આશાયી

નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર - શંકરપરા(બોટાદ)નો ભવ્ય



## મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ સત્સંગિજીવન કથા

વકતા :- પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી તથા પૂ. સ્વામી શ્રી પૂર્ણસ્વરૂપદાસજી

તારીખ :- ૧૧ થી ૧૭ ૩-૨૦૧૨

કથા સમય :- સવારે ૮.૩૦ થી ૧૧-૩૦ બપોરે ૩.૦૦ થી ૬.૦૦

આયોજક :- ધર્મકૃત આશ્રિત શ્રી સ્વામિનારાયણ મંદિર સત્સંગ સમાજ - શંકરપરા, બોટાદ (ગાટપુર પ્રદેશ)

મહોત્સવ સ્થળ :- ‘શ્રી સ્વામિનારાયણ મંદિર’ મુ. શંકરપરા, ખસ રોડ, બોટાદ

સંપર્ક :- વિરાજભાઈ - મો. ૯૮૨૪૮૫૮૨૩૮ હર્ષભાઈ - મો. ૮૪૨૮૧૦૮૧૭૫ હરેશભાઈ - મો. ૮૧૨૮૨૭૬૩૫૧

યાતો પીપરડી...

પદારો પીપરડી...

વડતાલ પીઠાધિપતિ વિદ્યમાન પ.પૂ. કુ. ૧૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્પ્રસાદજી મહારાજશ્રી તથા  
પ.પૂ. ૧૦૮ શ્રી ધર્મકૃત મુગટમણિ શ્રી નૃગ્રંધપ્રસાદજી મહારાજશ્રીના રૂપ આશીર્વાદ સહ આશાયી

નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર - પીપરડીનો ભવ્ય

## મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રીમદ્ સત્સંગિજીવન કથા

વકતા :- પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી તથા પૂ. સ્વામી શ્રી પૂર્ણસ્વરૂપદાસજી

તારીખ :- ૧૦ થી ૧૬ ૩-૨૦૧૨

કથા સમય :- સવારે ૮.૩૦ થી ૧૧-૩૦ બપોરે ૩.૦૦ થી ૬.૦૦

આયોજક :- ધર્મકૃત આશ્રિત શ્રી સ્વામિનારાયણ મંદિર સત્સંગ સમાજ - પીપરડી (ગાટપુર પ્રદેશ)

મહોત્સવ સ્થળ :- ‘શ્રી સ્વામિનારાયણ મંદિર’ મુ. પીપરડી, તા. ગાડા, જી. ભાવનગર

સંપર્ક :- મનસુખભાઈ - મો. ૯૮૭૮૨૮૮૧૭૮ મગનભાઈ - મો. ૮૮૭૮૮૯૧૩૩૭ દલસુખભાઈ - મો. ૮૪૨૮૮૮૬૩૫૬૬

॥ શ્રી સ્વામિનારાયણ વિજયતેતરામુ॥

વિદ્યમાન પ.પૂ. સનાતન પ.કુ. ૧૦૮ શ્રી આચાર્ય શ્રી અજેન્પ્રસાદજી મહારાજશ્રીના રૂપ આશીર્વાદ સહ આશાયી

શ્રી હરિકૃષ્ણ મહારાજ સૂત આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ દ્વિશતાબ્દી કૃતાંજલિ મહોત્સવ



## પ્રિદિનાત્મક શ્રીહરિયાગ

તારીખ :- ૮ થી ૧૧-૩-૨૦૧૨ ફાગણ સુદ-૧ થી ૪

નોંધ :- યશમાં યજમાનપદે બેસી લાભ લેવા ઈચ્છતા ભક્તોએ સંપર્ક કરવો.

સંપર્ક :- શ્રી સ્વામિનારાયણ મંદિર - ગાટપુર

ફોન :- ૦૨૮૪૭ - ૨૫૨૮૦૦ મો-૮૪૨૬૮૦૪૧૦૮



પ.પૂ. કુ. આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજશ્રી

સર્વચારણી ભગવાન શ્રી સ્વામિનારાયણ



યિતન



કેબ્યુલારી  
૨૦૧૨

॥ श्री स्वामिनारायणो विजयतेराम् ॥

## पवित्र श्रावण मासमां संतो-भक्तो साथे तीर्थयात्रानो अनेरो छावो

प.पू. सनातन प.पू. १०८ श्री विद्यामान आशार्य श्री गोपेन्द्रप्रसादाशु महाराजाशीना दुर्गा आशीर्वां सह आशार्य

'श्रीहरिकृष्ण महाराज सुत आशीर्वायार्य श्री श्रुतिरेखु महाराज द्विशतानी कृष्णांगलि महोत्सव' वर्षमां

श्री स्वामिनारायण मंदिर - सरधार द्वारा आयोजित यारथामनी नवमी



प्रयोजक :- प.पू. सदृ. स्वामी श्री नित्यस्वरूपदासज्ञ - पड़ताल (काश-सरधार)

तारीख :- ४-७-२०१२ श्रावण वृद्धि - १ थी  
३१-७-२०१२ श्रावण सुदृ - १३

कुल दिवस :- २८ दीर्घी दर :- रु. २५,५००



### दर्शनीय पवित्र तीर्थस्थानो

**नामिक :-** गोदावरी स्नान, कुंभपर्वतुं तीर्थधाम, श्री रामयंद्रज्ञाना रसोर्ध धर, ईन्द्रध्युम्न सरोवर, रथयात्रानां रथ दर्शन, गुंटीया वनवासनुं निवास स्थान पंचवटी, सीतागुफा, कालाराममंदिर, मंदिर, जनकपुरी, स्वर्ग द्वार, समुद्र तट, तीबाणीया, श्री नीलकंठ गोराराममंदिर, तोपेवन आश्रमश्री स्वामिनारायण मंदिर तथा वर्षीना वनविचरणातुं प्रसादीनुं स्थान. (ओरिस्सा राज्य)  
मुक्तिधाम, श्री नीलकंठ वर्षीना वनविचरणातुं प्रसादीनुं स्थान. साक्षीगोपाल :- भगवान श्री कृष्णयंद्रज्ञानुं मंदिर, श्री नीलकंठ (महाराष्ट्र राज्य)  
वर्षीना वनविचरणातुं प्रसादीनुं स्थान. (ओरिस्सा राज्य)

**अंबेक्ष्यर ज्योतिर्लिंग :-** भार ज्योतिर्लिंगमां एकतमस्थान भुवलेश्वर :- आ शहेरमां भगवान शंकरानुं मंदिर छे, 'लीगराज धरावता भगवान श्री शिवशंकरना ज्योतिर्लिंग अंबेक्ष्यरना स्वामी' तरीके प्रभ्यात छे. तेमज बीहुं नामभुवनेश्वर छे. श्री दर्शन. श्री नीलकंठ वर्षीना वनविचरणातुं प्रसादीनुं स्थान. नीलकंठ वर्षीना वनविचरणातुं प्रसादीनुं स्थान. (ओरिस्सा राज्य)

**पंटपुर :-** चंद्रबागा नदीमां स्नान, भगवान श्री विष्णुलनाथज्ञाना धोलागीरी :- अहि पहाड उपर शांतिस्नृप बौद्ध स्मारक दर्शन, दर्शन, श्री नीलकंठ वर्षीनुं प्रसादीनुं स्थान. (महाराष्ट्र राज्य)

अशोक स्मारकानुं वैराग्य उत्पन्न स्थान. (ओरिस्सा राज्य)

**रामेश्वर :-** भारत देशना मुख्य चार तीर्थधामो मांडिलुं एक धाम, काशी/वाराणसी :- श्री काशी विश्वनाथज्ञ मंदिर, पवित्र गंगाज्ञ भगवान श्री शिवशंकरानुं भगवान श्री रामयंद्रज्ञामे पधरावेल स्नान, दशाधमेष तथा काशी वाटना दर्शन, श्री स्वा. मंदिर दर्शन, ज्योतिर्लिंग, अति भव्य मंदिर अने विशाण परिकमा, २२ कुप तुलसीदासज्ञामे रामचरित्र मानस लाखेल ते संकटमोचन मंदिर, स्नान, स्फटिक शिवलींग दर्शन, समुद्र स्नान. श्री नीलकंठ वर्षीना हुर्गा मंदिर, बनारसी सारीओहुं बजार. (उत्तरप्रदेश राज्य)  
वनविचरणातुं प्रसादीनुं स्थान. (तामिलनाडु राज्य)

अल्लामाई :- गंगा-यमुना-सरस्वती नदीना त्रिवेणी संगममां

**श्रीरंगक्षेत्र :-** भगवान श्रीरंगनाथज्ञानुं भव्य मंदिर तथा दक्षिणा स्नान, अशोकनो डिल्लो, अक्षयवद, श्री स्वा. मंदिर दर्शन, सुतेला भारतनी गंगा समान कावेरी नदीनुं पवित्र तीर्थ सरीतामां स्नान, हनुमानज्ञ मंदिर, भारद्वाज ऋषि आश्रम, आनन्द भवन. श्री रामानुजाचार्यनी हिव्यटेहशी सदा प्रत्यक्ष संनिधि तेमज श्री (उत्तरप्रदेश राज्य)

**नीलकंठ वर्षीना वनविचरणातुं प्रसादीनुं स्थान.** (तामिलनाडु अयोध्या :- श्री रामजन्मभूमि, सरयु नदी स्नान, कनक भुवन, हनुमानगढी, श्री स्वामिनारायण मंदिर, शहेरमां पांच हजार)

**तिरुपति भालाजु :-** भगवान श्री तिरुपति (लक्ष्मीपति) मंदिरथी वधु मंदिरो. (उत्तरप्रदेश राज्य)

**बालाज्ञानुं भव्य मंदिर, सुवर्णना धूममटवाणुं भारतनुं ४ नलि छप्या :-** भगवान श्री स्वामिनारायणानुं प्रागट्यस्थान दर्शन, परंतु विश्वभरनुं सौथी समृद्ध मंदिर, तिरुमाला पर्वत उपरनां नारायण सरोवर स्नान, गौघाट, श्रवण तणावटी, धांपां तणावटी, दर्शनीय स्थानो तथा तणेतीमां श्री गोविंदराज मंदिर, महाप्रभु श्री भग्नोदाघाट वगरे, धम-झक्किना ओटा, संगेमरमर पथरमां नीलकंठवर्षीना वनविचरणातुं प्रसादीस्थान वेंकटादि. (आंप्रपटेश नूतन श्री स्वा. मंदिर दर्शन.  
(उत्तरप्रदेश राज्य)

**जगत्काशपुरी :-** भारत देशना मुख्य चार तीर्थधामो मांडिलुं एक हरिदार :- गंगाज्ञमां स्नान, हरकी धाम, भगवान जगत्काशनुं मंदिर, माधवरायनुं मंदिर, जगत्काशनुं पैदी-गंगामाता आरती दर्शन, श्री

आयोजक :- श्री स्वामिनारायण मंदिर - सरधार, ता.ज. राजकोट - ३६००२५. मो. ७६००५८५०३, ८८९६९५८५०३

Visit us : [www.sardarkatha.com](http://www.sardarkatha.com) • E-mail : [sardarmandir@gmail.com](mailto:sardarmandir@gmail.com), [balswami2008@yahoo.com](mailto:balswami2008@yahoo.com), [nyalkaran.11109@gmail.com](mailto:nyalkaran.11109@gmail.com)



સ્વામિનારાયણ મંદિર દર્શન, પાવનધામ ભારત માતા મંદિર વગરે નીલકંઠ વર્ણિના વનવિચરણાનું પ્રસાદીનું સ્થાન. (ઉત્તરાંધ્ર દર્શન તેમજ ખરીટી માટેનું ઉત્તમ બજાર. શ્રી નીલકંઠ વર્ણિના રાજ્ય)

વનવિચરણાનું પ્રસાદીનું સ્થાન. (ઉત્તરાંધ્ર રાજ્ય)

મધુરા :- ભગવાન શ્રીકૃષ્ણાંદ્રજીનું પ્રાગાટ્ય સ્થાન, વિશ્વામિદાન.

કનખલ :- અહીં યજ્ઞમાં સતી પાર્વતીજી બળ્યા હતા તે દક્ષ પ્રજ્ઞાપતિ શ્રી યમુનાજ્ઞમાં સ્નાન, શ્રી સ્વા. મંદિર દર્શન. (ઉત્તરપ્રદેશ રાજ્ય) રાજ્યાના મંદિર દર્શન.

ગોકુલ :- ખ્રાંતં ઘાટ, નંદજનો ૮૪ સ્થંભપુષ્ટ મહેલ તેમજ

અધિકેશ :- જગપ્રસિદ્ધ પૌરાણિક ગામ, રામજુલા, સાતમાણનું પ્રાચીન ગોકુલગામ.

મંદિર, પરમાર્થ નિકેતન, ગીતાભવન, સ્વર્ગાશ્રમ, ગંગાસ્નાન. શ્રી સમધારેતી :- ભગવાન શ્રીકૃષ્ણના ચરણરજીથી ધન્ય બનેલ ભૂમિના નીલકંઠ વર્ણિના વનવિચરણાનું પ્રસાદીનું સ્થાન.

દર્શન.

લક્ષ્મણ ગુલા :- લક્ષ્મણજીએ બાર વર્ષ તપ કરેલું તે સ્થાને લક્ષ્મણ વૃંદાવન :- કદમ્બ વૃશ્ટ, કાલિંગી, સેવાંકુંજ, ઈસ્કોન મંદિર, જુલા મંદિર દર્શન, શ્રી નીલકંઠ વર્ણિને અહીં રાત્રિરોકાણ કરેલું. પાગલભાબા મંદિર વગેરે...

કેદારનાથ :- ભાર જ્યોતિરિંગમાનું એક શિવલેણ, અમૃત કુંડ, હારિકા :- ભારત દેશના મુખ્ય ચાર તીર્થધામો માંછિલું એક ધામ, રેતકુંડ, હંસકુંડ વગેરે કુંડો, તમસુંડો દર્શન. શ્રી નીલકંઠ વર્ણિના શ્રી હારિકાધીશ દર્શન, ગોમનીજ સ્નાન, શ્રી સ્વા. મંદિર, વનવિચરણાનું પ્રસાદીનું સ્થાન. (ઉત્તરાંધ્ર રાજ્ય)

ગોપીતણાવ (મહાપ્રભુની બેઠક), શ્રી રૂક્મણીજી મંદિર,

ભડીનાથ :- ભારત દેશના મુખ્ય ચાર તીર્થધામો માંછિલું એક ધામ, શંકરાચાર્યજીની ગાઢિ-શારદાપીઠ, નાગેશ્વર જ્યોતિરિંગ, શ્રી બદ્રીનાથ ભગવાનનું મંદિર, શ્રી સ્વા. મંદિર દર્શન, અલકંદંદા બેદદ્વારિકા દર્શન. (ગુજરાત રાજ્ય)

નદીને કિનારે તમસુંડ, નારદ કુંડ, નારસિંહી શીલા વગેરે દર્શન. શ્રી

તો આવો... આ સોનેરી અવસર રખો ચૂકી ન જઈએ !!!

પવિત્ર બ્રહ્મનિષ સંતો-ભક્તોના સાંનિધ્યમાં દિવ્યાનંદ માણસા... અલગ-અલગ પ્રાંતોની દાકોરજીની સેવારીતિ અને ભક્તિભાવને નિહાળવા... આભે આંદેલા દિવ્ય-ભવ્ય મંદિરોના દર્શન સાથે એદ્ભૂત કલાત્મક નકશી કોતરણીઓ નિહાળવા... પવિત્ર શ્રાવણ માસના દિવસો સતત તીર્થદર્શન, ભજન-ભક્તિ, કથાવાર્તા અને સત્સંગમય આનંદથી વીતાવવા...

**યાએ વિષે અગાટ્યાની માહિતી... :** એક જ ડબ્બામાં સાથે સાથે રહેવા ઈચ્છતા યાત્રિક ભક્તોએ, જેની સાથે રહેવાનું હોય તેમની સાથે પોતાનું નામભાવાવાથી તે શક્ય બની શકશે. યાત્રિક તરીકે પુરુષો તથા સ્ત્રીભક્તો એમબંને જોડાઈ શકશે. એક જ સ્ત્રીભક્ત હોય તો તેને રસ્તામાં સાઝા-માંદા કે અન્ય તકફિલ આવી પડે તો તેમના કોઈ જાણીતા પુરુષ સંબંધી હોવા જરૂરી છે.

**ટીકીટ દર :-** યાત્રાપ્રવાસ-ભોજન તથા દર્શનની બસ વ્યવસ્થાના ખર્ચ સાથે ટીકીટનો દર એક ટીકીટના રૂ. ૨૫, ૫૦૦/- રાખવામાં આવેલ છે. \* ખુંડિગ સમયે રૂ. ૧૦,૦૦૦/- ભરવાના રહેશે તેમજ બાકીની રકમટીકી ટીઠ રૂ. ૧૫,૫૦૦/- યાત્રાપ્રવાસ ઉપડતા પહેલા ત૩૦ દિવસે બચી ટેવાના રહેશે. જાસનોંધ : પાંચ વર્ષ કે તેથી ઉપરના બાળકોની સ્પેશિયલ ટ્રેનમાં રેલે બોર્ડ દારા અડાદી ટીકીટ અપાતી નથી, માટે તેની પણ આપી ટીકીટ જ લેવાની રહેશે.

**ભોજન વ્યવસ્થા :-** કિયનકારથી સજ્જ સ્પેશયલ ટ્રેનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની આજા પ્રમાણે શુદ્ધ અને ગાળી-ચાળીને પવિત્રપણે સંતો-ભક્તોના હાથે નાનાવેલ અને દાકોરજીને થાળ ધરીને બંને સમય સ્વાદિષ્ટ ભોજન તથા સવારે નાસનો પીરસવામાં આવશે. જાસનોંધ : યાત્રાપ્રવાસમાં કોઈને પણ બજારણ ખાદ્ય પદાર્થ યાંગળી-લસણ વગેરે ચીજાવસ્તુઓ ટ્રેનમાં લાવવા દેવામાં આવશે નહિ.

**યાએ વ્યવસ્થા :-** યાત્રાપ્રવાસ રેલવેને સંપૂર્ણ સ્પેશિયલ ટ્રેન દ્વારા આયોજન કરેલ છે. જેમાં શ્રીયાત્રિર સ્લિપર કલાસમાં દરેક યાત્રિને સ્વતંત્ર સુવાની સગવડા મળશે. તેમજ આરામથી બેસીને યાત્રાને માણી શકશે. અને યાત્રાપ્રવાસ દરમાનાં યાંત્રીસ્થળોએ તીર્થમાદાત્મ્ય શ્રવણ તેમજ કથા-વાર્તાનો લાભ સંતોની અમૃતવાણી દ્વારા સંપૂર્ણ યાત્રાપ્રવાસમાં મળતો રહેશે.

**દર્શન તથા વાહન વ્યવસ્થા :-** રેલ્વે રેલેશનથી યાત્રાપ્રવાસ સૂચિના દર્શનીય સ્થળોને જવા આવવાના ખાસ સ્પેશયલ બસો વગેરે મુકવામાં આવશે. તે વાહન વ્યવસ્થાની ટીકી ખર્ચમાં સમાવેશ થઈ જાય છે. \* ટીકીટમાં હોલી, તોલી, ધોડા, ટાંગા તથા જોવાલાયક સ્થળોની પ્રવેશ કી વગેરેને સમાવેશ થતો નથી. \* સ્થાનિક ટ્રૌટીકાના નિયમો પ્રમાણે બસનો પ્રવેશ માયા હશે તાંત્રાં સુધી જો અને સૌંકડા માર્ગો ઉપર બસ ન જઈ શકે તાંત્રાં ચાલીને કોપોતપોતાની રીતે જવાનું રહેશે.

નુંદિંગ માર્ટ સેન્ટર :- શ્રી સ્વા. મંદિર - સરધાર. ૭૬૦૦૦૫૮૫૦૫ (પૂ. પાતિતપાવન સ્વામી) ૮૮૦૫૮૮૦૮૮૦ (મહેતાજ). શ્રી સ્વા. મંદિર - શ્રીખુનાગ સુરત. મો. ૮૧૨૮૬૮૮૧૫૧૩. પૂ. ધર્મવિલલન સ્વામી - વડાલ. મો. ૭૬૦૦૦૨૭૧૩૪. શ્રી સ્વા. મંદિર - ડોલીયલી ફોન. ૦૨૫૧-૨૪૪૩૮૭૫૫૫૫. શ્રી સ્વા. મંદિર - ખારગેત મહુવા. મો. ૮૧૨૮૬૮૮૧૫૧૫. શ્રી સ્વા. મંદિર - લગ્ઝસરા. ફોન. ૦૨૭૬૮-૨૨૨૪૪૧, ૮૧૨૮૬૮૧૫૦૨. માનસુખાઈ દહિનાર. મો. ૮૮૩૮૩૫૧૦૧૨. અરોકાઈ વિધાનગર. મો. ૮૮૨૪૪૪૮૩૩૮૭. પ્રવિષ્ણાઈ માનસ્વા - ભૂજ. મો. ૮૮૨૪૭૮૪૮૫૮૫. ગોયિંગલાઈ માનનુદ્વા - ભૂજ. મો. ૮૮૨૪૫૩૭૮૪૮૪. રાબુલાઈ સુધુપુનું - ભૂજ. મો. ૮૮૨૪૭૯૩૪૪૩૫. ઈશ્વરલાઈ વિકાસ મોટર્સ - અમદાવાદ. મો. ૮૮૨૪૫૦૪૮૧૦૮. નાયાલાઈ અમદાવાદ. મો. ૮૮૭૯૫૧૩૨૩૨. શાંતિલાઈ માનાવાદ. મો. ૮૮૨૪૪૧૬૭૭૦૮. વિંમતલાઈ ધંધુકા. મો. ૮૮૨૪૪૮૮૮૮૦૮.





॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ॥

## શ્રીજી પ્રસાદભૂત ભુપગઠને આંગણે...

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની મુવાસને યુગપ્રાભાવી કરનાર અને વિધમાન પ.પૂ. ધ.ધ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી આજેન્ડ્રપ્રસાદજી મહારાજશ્રીના અનુગામી અને પનોતા સત્યુત્ત્ર

**પ.પૂ. ૧૦૮ શ્રી ધર્મકુળ મુગટમણિ  
શ્રી નૃગોદ્વપ્રસાદજી મહારાજશ્રીનો  
હિંય અને ભલ્ય**

**સમય :- બપોરે ૩.૦૦ થી ૬.૦૦**

**આયોજક :- ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજ - ભુપગઠ (ગાઢપુર પ્રદેશ)**

**મહોત્સવ સ્થળ :- મુ. ભુપગઠ, તા. જી. રાજકોટ**



**તારીખ :- ૧૨-૩-૨૦૧૨**

**ફાગણ વદ - ૫ (રંગપંચમી)**



વડતાલ પીઠાધિપતિ વિધમાન પ.પૂ. ધ.ધ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી આજેન્ડ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ધર્મકુળ મુગટમણિ શ્રી નૃગોદ્વપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આશાદી લૂટન શ્રી સ્વામિનારાયણ મંદિર - કરમદીયાનો ભવ્ય

## મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

અંતર્ગત



પ્રારંભ

તા. ૨૫-૨-૨૦૧૨

ફાગણ સુદ - ૩

## શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયાએ

- વક્તા :-

પૂ. સ. ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

પૂ. શા. ગોવિંદપ્રદાદસજી (ઘાંધીયા)

પૂ. સ્વામી શ્રી પૂર્ણસ્વરૂપદાસજી

:: કથા સમય ::



પૂર્ણાદુતિ

તા. ૨૮-૨-૨૦૧૨

ફાગણ સુદ - ૭



૧૦૦૮ કથા પારાયાએ કુર્માદુતિ શ્રી નિત્યસ્વરૂપદાસજી

- આયોજક :-

ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામિનારાયણ મંદિર સત્સંગ - કરમદીયા (ગાઢપુર પ્રદેશ)

મહોત્સવ સ્થળ :- શ્રી સ્વામિનારાયણ મંદિર મુ. કરમદીયા, તા. મહુવા, જી. અમરેલી

સંપર્ક :- નાયાભાઈ - મો. ૮૭૨૩૬૧૮૮૨ તુલસીભાઈ - મો. ૮૮૨૫૩૫૭૬૧

ચાલેકોલાપુર...

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ॥

વડતાલ પીઠાધિપતિ વિધમાન પ.પૂ. ધ.ધ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી આજેન્ડ્રપ્રસાદજી મહારાજશ્રી તથા પ.પૂ. ૧૦૮ શ્રી ધર્મકુળ મુગટમણિ શ્રી નૃગોદ્વપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદ સહ આશાદી

## નૂટન શ્રી સ્વામિનારાયણ મંદિર - જોલાપુરનો ભવ્ય

## મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

અંતર્ગત શ્રીમદ્ સત્સંગિજીવન

કથા :- પૂ. સ. ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી તથા પૂ. સ્વામી શ્રી પૂર્ણસ્વરૂપદાસજી

તારીખ :- ૨૬-૨-૨૦૧૨ થી ૧-૩-૨૦૧૨

-:: કથા સમય ::-

સવારે ૮.૩૦ થી ૧૧-૩૦ બપોરે ૩.૦૦ થી ૬.૦૦

પ્રદાર  
ભેલાપુર...



આયોજક :- ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામિનારાયણ મંદિર

સત્સંગ સમાજ - જોલાપુર (ગાઢપુર પ્રદેશ)

-: મહોત્સવ સ્થળ :-

મુ. જોલાપુર, તા. રાજુલા, જી. અમરેલી

સંપર્ક :- દેવસુરભાઈ - મો. ૮૭૨૩૩૮૨૫૪૮

વાજસુરભાઈ - મો. ૮૮૦૪૪૦૪૪૮૮





ગોડલ શહેરને આંગણે પ.પુ. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી પ.પુ. લાલજી મહારાજશ્રીના દિવ્ય સાનિધ્યમાં ઉજવાયેલ શિખરબધ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરનો '૧૪૧મો વાર્ષિક પાટોત્સવ' (તા. ૧ થી ૭-૨-૨૦૧૨)

જે ધરાને શ્રીઘ્રમહારાજે પોતાના પાવનકારી ચરણારવિંદથી પવિત્ર કરી છે તેમજ સ.ગુ. શ્રી ગુણતીતાનંદ સ્વામી, સ.ગુ. શ્રી કૃપાજીવનદાસજી સ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ વચનસિદ્ધ સંબોધ વર્ષો સુધી નિવેસ કરેલ છે એવા જૂનાગાટવાસી શ્રી રધારમણ દેવની છત્રશાળાના ગોડલ શહેરને આંગણે સં. ૧૮૨૬ મહા સુદ - ૧ ઉના રોજ પ.પુ. ધ.ધુ. આચાર્ય શ્રી ભગવતપ્રસાદજી મહારાજશ્રીના શુભ વરદદ્દ વેદીકણવિધારા શિખરબધ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રતિજ્ઞા કરવામાં આવી હતી એવા શ્રીરિક્ષણ મહારાજ, શ્રીરમ-નાન્દિતાત્મા શ્રી રધારદ્ધા આદિક ટેવોનો પૂ. કો. સ.ગુ. સ્વામી શ્રી સંતવાલભદાસજીના માર્ગદર્શન પ્રમાણે '૧૪૧મા વાર્ષિક પાટોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરથરનિવાસી પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યાસ્વરપદાસજીના વકતાપણે રહીને શ્રીમદ્ સત્યાગ્નિજીવન કથાપારાયણનું રસપાન કરાયું હતું. તા. ૪-૨-૨૦૧૨ રના રોજ પ.પુ. લાલજી મહારાજશ્રીના ભવ્ય શોભાયાત્રા ગોડલ શહેરના રાજમાર્ગો પર કાઢવામાં આવી હતી. આ મહોત્સવમાં ગોડલ રાજજી શ્રી અચ.અ.સ. મહારાજ શાહેબ શ્રી જ્યાતિરસિંહજીનું સાફો તેમજ સન્માનપત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. તા. પ-૨-૨૦૧૨ રના રોજ શાકોત્સવ પ્રસ્તુત ગોડલ શહેર બુમાદાબંધ રામવામાં આવ્યું હતું. તમામ શાંતિના ધર્મપ્રેમી જનતાએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

આજ આનંદ આનંદ રે, આનંદ મારે આંગણીએ; બાળલાલજી પધાર્યા રે, આનંદ અમારે આંગણીએ...  
**ધર્મકુળ દેર ખાંદ ભયો, જથ બોલો બાળલાલજી કી...**

વાંસતી પુષ્પોની સૌરભ સમાન સંપ્રદાયની આન-બાન-શાનને વધારવા પોષ વદ - ૧૧એ પ્રગટેલા.  
 પ.પુ. બાળલાલજી શ્રી રાણોન્ડપ્રસાદજી શ્રી નૃગોન્દપ્રસાદજી મહારાજશ્રી - વડતાલ



**શ્રી રઘુવીર વાડી - વડતાલને આંગણો પ.પુ. લાલજી મહારાજશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ઉજવાયેલ  
પ.પુ. બાળલાલજી મહારાજશ્રીનો 'નામકરણ સંસ્કાર મહોત્સવ' (તા. ૩૦-૧-૨૦૧૨ મહા સુદ - ૭)**

૧. પ.પુ. બાળલાલજી મહારાજશ્રીને દાકોરજના દર્શન કરાવતા બંને પૂ. બહેનશ્રીઓ. ૨. નામકરણ સંસ્કારના એક ભાગરૂપે સૌપ્રથમ પ.પુ. બાળલાલજી મહારાજશ્રીને સુવર્ણ અલંકાર ધારણ કરાવતા પ.પુ.લાલજી મહારાજશ્રી તથા પ.ભ. ઘનશ્યામભાઈ સોની - વડોદરા. ૩. પ.પુ. બાળલાલજી મહારાજશ્રીને પારણામાં પથરાવતા પૂ. બાબારાજ શ્રી ઉર્વિશીબા. ૪-૫. પ.પુ. બાળલાલજી મહારાજશ્રીનું નામકરણ કરતા પૂ. મોટા બહેનશ્રી રમાંકુરબા તથા પૂ. બાબારાજ શ્રી ઉર્વિશીબા. ૬. પ.પુ. બાળલાલજી મહારાજશ્રીને પારણો જૂલાવતા પૂ. લાલીરાજ શ્રી રાજનાન્દિનીબા તથા ધર્મકુણ પરિવાર. ૭-૮. પ.પુ. બાળલાલજી મહારાજશ્રીને સુવર્ણહાર પહેરાવીને પ્રથમ દર્શનનો લાલો લેતા પૂ. સ્વામી, પૂ. એસ.પી. સ્વામી, પૂ. યેરમેન સ્વામી વગેરે સંતો. ૯. નામકરણ સંસ્કાર સભામાં પ.પુ. લાલજી મહારાજશ્રીનું પુષ્પમણા પહેરાવીને સ્વાગત કરતા જૂનાગઢ મંદિરના નવા નિયુક્ત મહંત પૂ. કે.પી. સ્વામી. ૧૦-૧૧. નામકરણ સંસ્કાર મહોત્સવમાં ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સંતો-હરિભક્તો તથા સાંખ્યયોગી-કર્મયોગી શીભક્તો. ૧૨. પાર્કિંગ વિભાગનું દેશ્ય.

ચાલો  
કતારગામ

પદાર)

કતારગામ

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતેતરમ્ય ॥

વિધમાન પ.પૂ. સનાતન પ.ડ.બુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી અનુભૂતપ્રસાદજી મહારાજાના દૂર આશીર્વાદ સહ આશાથી સુરત શહેરને આંગણે અતિ ભવ્ય આંતરરાષ્ટ્રીય દ્વિતીય સોપાન.

શ્રી હરિકૃષ્ણ મહારાજ સૂત



આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ

# દ્વિશાતાબદી કૃતાજ્જલ મહોત્સવ

શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણ

સુરત - ૨૦૧૨



પ.પૂ. પ.ડ.બુ. આદિઆચાર્ય  
શ્રી રઘુવીરજી મહારાજાની



સર્વાંગતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ

મહોત્સવ અધ્યક્ષશ્રી



પ.પૂ. પ.ડ.બુ. ૧૦૮ શ્રી અનુભૂતપ્રસાદજી મહારાજાની - વડતાલ

વક્તા :- પૂ. સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી

તારીખ :- ૧ થી ૮ - ૩-૨૦૧૨

કથા સમય :- બપોરે ૩.૩૦ થી ૬.૩૦, રાતે ૮.૦૦ થી ૧૧.૦૦

ઓફલાઇન

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ, ગઢા, જૂનાગઢ, પોલેરા પ્રદેશોના સમસ્ત સત્સંગ સમાજ વતી

ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજ - સુરત

Online :- [www.swaminarayananvadtalgadi.org](http://www.swaminarayananvadtalgadi.org)



પ.પૂ. ૧૦૮ શ્રી ધર્મકુળ મુગટમણી  
શ્રી નગેન્દ્રપ્રસાદજી મહારાજાની - વડતાલ

વિશેષ આયોજનો

- ૧૦૮ સંહિતાપાઠ
- અખંડધૂલ
- મહામંત્ર લેખન
- શ્રી ધનશ્યામ જન્મોત્સવ
- પણ્ડિતેજ મહોત્સવ
- અખેકૂદોત્સવ
- કૂલદોલોત્સવ
- શાકોત્સવ
- રાસોત્સવ
- નગર-શોભાયાત્રા
- જ્વલ ડોલેશન કેમ્પ
- સર્વરોગનિદાન કેમ્પ

મહોત્સવનું જુવંત પ્રસારણ



GTPL (ઓલ ગુજરાત) હિન્દુ રીયાલ

મિત્ર વરાણી નેટવર્ક DEN

યેનલ ઉપર કરવામાં આવશે.

પોશીયાં

તા. ૪-૩-૧૨ ફાગુન સુદ - ૮, રાતે ૮.૩૦ કલાક  
શાલમાણશીલા ઘરથી લોકોની મહોત્સવ રહેણ જરૂર  
(૧૧, કી.ગેમ. પાડ ઘણાણ કોમ્પની તામે, કતારગામ)

છનીકાત્મક વિદ્યા વિભાગ - સુરત, મો. ૮૮૨૮૮૮૫૪૧૩, જ્યેષ્ઠ ટાંક - કાંદિવલી, મો. ૮૩૨૪૦૬૦૨૪૭, શિવલાલ સુધારી - બારમણ, મો. ૮૮૦૮૮૮૫૪૦૮૦ પરેશ જ્યુગર - આંસેં, મો. ૮૮૨૫૦૫૦૦૮૦

Printed and Published by Swami Viraktswrupdasji on behalf of Sardhar and Printed at Shreeji Art, GF-12, Ashirvad Shopping Center,  
Ashram RD, Paldi - A'MD. and Published from Shree Swaminarayan Temple - Sardhar, Dist-Rajkot - 360025. Editor - Sadhu Patitpavandasji  
(સનાતન :- ૧૧, લક્ષ્મીનારાયણ તોટા, કેરોડ.)

મહોત્સવ સ્થળ

‘શ્રી રઘુવીર ધામ’  
લલિતા ચોકડી, કતારગામ, સુરત

ભવા સ્વાગત નગર-શોભાયાત્રા

તા. ૪-૩-૨૦૧૨ ફાગુન સુદ - ૧૧ રવિવાર,  
બપોરે ૩.૦૦ કલાક  
(સનાતન :- ૧૧, લક્ષ્મીનારાયણ તોટા, કેરોડ.)